



# ગોધ્યાલ

સ્થાપના : ૨૦૧૭  
વિકાસ સંયત : ૨૦૭૩

કામદેણુ યુનિવર્સિટીનું દ્રિમાસિક પ્રકાશન

વર્ષ : ૦૧

અંક : ૦૪-૦૫

જુલાઈ-ઓક્ટોબર, ૨૦૧૭

સંખ્યા અંક : ૦૪-૦૫





# કામદેનુ યુનિવર્સિટી

## ગાંધીનગર

### દ્રષ્ટિ

આ યુનિવર્સિટી પશુચિકિત્સા અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ નેતૃત્વ પુરું પાડવાની નેમ ધરાવે છે.

### હેતુ

સર્વ જીવોના કલ્યાણ અર્થે સદાય ચત રહેવું.

### દ્વયેચ

- શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સર્વ શ્રેષ્ઠતા હાંસલ કરવી તેમજ દરેક ક્ષોળોમાં પ્રગતી થકી સમગ્ર જીવસૃષ્ટિના ઉદ્ઘાર માટે કાર્ય કરવું.
- વિધાર્થીઓનું કરણામય વ્યાવસાયિકો તરીકે જીવન ઘડતર કરવું.
- જ્ઞાનના આદાન-પ્રદાન ક્રારા પશુપાલન, ડેરી અને મલ્ટ્યુપાલનમાં ઉત્પાદકતા વધારીને પશુપાલકો તેમજ મત્સ્ય ઉત્પાદકોને આર્થિક રીતે સક્ષમ બનાવવા.

### અનુસ્નાતક કાર્યક્રમો

- અનુસ્નાતક પશુચિકિત્સા શિક્ષણ અને સંશોધન સંસ્થાન, ગાંધીનગર
- અનુસ્નાતક ડેરી શિક્ષણ અને સંશોધન સંસ્થાન, અમરેલી
- અનુસ્નાતક મત્સ્ય શિક્ષણ અને સંશોધન સંસ્થાન, ગાંધીનગર

### અંગભૂત સંસ્થાઓ

- ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય, અમરેલી
- પશુપાલન પોલીટેકનિક, રાજપુર (નવા) હિંમતનગર

### સંલગ્ન સંસ્થાઓ

એક ડેરી વિજ્ઞાન મહાવિદ્યાલય – (MIDFT, મહેસાણા) અને સાત પશુપાલન પોલીટેકનીકો ગુજરાતના વિવિધ સ્થળો પર કાર્યરત છે.

### સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ :

કામદેનુ યુનિવર્સિટી મહિલા પશુપાલકો માટેના તાલીમ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરે છે અને નિયમિત રીતે પશુપાલકોના લાભ માટે ગુજરાતી સામયિક “ગૌધૂલિ” તેમજ અન્ય વિસ્તરણ સામગ્રી લેમકે પરિકાઓ, સામયિકો વગેરે પ્રકાશિત કરે છે. કામદેનુ યુનિવર્સિટી તેના વિસ્તરણ કાર્યક્રમ તરીકે પશુ સારવાર અને રોગ નિદાન કેખ્પ, પશુપાલકો માટે પ્રશિક્ષણ કાર્યક્રમો, મહિલા પ્રશિક્ષણ કાર્યક્રમો, ખેડૂત મેળાઓ, સ્પર્ધાઓ અને પ્રદર્શનોનું આયોજન કરે છે.

University Flag



:: સંપર્ક ::

ડૉ. પી. એચ. વાટલીયા

કુલપતિ અને વિસ્તરણ શિક્ષણ નિયામક,  
કામદેનુ યુનિવર્સિટી

કર્મયોગી ભવન-૧, બી-૧ વિંગ, ચોણો માલ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર  
ફોન નં. ૦૭૯-૬૪૫૭૨૬૬૬૬, ૬૪૭૨૦૧૩૧

E-mail : [dee@guj.com](mailto:dee@guj.com), Website : [www.ku.org](http://www.ku.org)



એક પગાં સ્વચ્છતા તરફ



કામધેનુ યુનિવર્સિટી  
કર્મયોગી ભવન, બ્લોક-૧,  
જથ્થો માળ, બી-૧ વીંગ,  
સેક્ટર-૧૦-એ,  
ગાંધીનગર-૩૮૨૦૧૦

**ડૉ. પી. એચ. વાટલીયા**

કુલપતિ અને  
વિસ્તરણ શિક્ષણ નિયામક

**ગૌધૂલિ વેળાએ.....**

**તંત્રી સ્થાનેથી.....**

ભારત દેશની અર્થ વ્યવસ્થામાં આધારભૂત યોગદાન આપનાર પ્રાચીન વ્યવસાય પશુપાલન અત્યારે બેતીનો પૂરક વ્યવસાય ન રહેતા મુખ્ય વ્યવસાય તરીકે સ્વતંત્ર રીતે વિકસી રહ્યો છે. ગુજરાત રાજ્યે દૂધ ઉત્પાદન ક્ષેત્રે શેત કાંતિ થકી દેશ અને વિશ્વમાં નામના મેળવી છે. તેરી ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓ થકી પશુપાલક મહિલાઓ પગભર થઈ પોતાના કુટુંબનું સફળ રીતે ગુજરાત ચલાવે છે. મહિલા પશુપાલકોએ જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ નોંધપાત્ર સફળતા મેળવીને પુરસ્કારો પણ મેળવ્યા છે જે અન્ય મહિલાઓ માટે પ્રોત્સાહક નિવેલ છે. પશુપાલન આપણા ગામડાઓની આર્થિક સ્વનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનું આવશ્યક અંગ છે. પશુપાલકોમાં આદર્શ પશુપાલન અંગેની વૈજ્ઞાનિક સમજ અને કૌશલ્ય કેળવાય તે હેતુથી કામધેનુ યુનિવર્સિટી દ્વારા “ગૌધૂલિ” દ્વિ માસિકનું નિયમિત પ્રકાશન કરવામાં આવે છે.

“ગૌધૂલિ”ના પ્રસ્તુત અંકમાં પશુપાલનના વિવિધ મુદ્દાઓને આવરી લેતા લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યની ભેંસની ઓલાદો, પશુઓના આરોગ્યની જગ્ઘાણી, પશુ ઓળખની પદ્ધતિઓ, દૂધાળા પશુઓમાં કષ્ટદાયક વિયાણના કારણો, તેના નિદાન અને ઉપચાર, દૂધમાં થતી ભેળસેળની ચકાસણી, પશુપાલન થકી મહિલા સશક્તિકરણ વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આશા છે કે પ્રસ્તુત અંકમાં આપેલ માહિતી અને જ્ઞાન પશુપાલકોને ખુબજ ઉપયોગી નિવડશે.

સૌ લેખકોને માહિતી સભર લેખો તૈયાર કરવા બદલ ધન્યવાદ આપું છું. વધુમાં પશુપાલકો માટે ઉપયોગી લેખો તૈયાર કરી “ગૌધૂલિ” નાં ભાવિ અંકમાં પ્રસિદ્ધ કરવા માટે મોકલી આપવા તજશોને આદ્ભુત કરું છું.

ઇશ્વર: સર્વ ભૂતાનાં | સર્વ ભૂત હિતે સ્તા: |

**ભવદીય,**

*૧૧/૨૦૧૮*

**(પી. એચ. વાટલીયા)**



# गौधूलि

કામધેનુ યુનિવર્સિટીનું દ્વિમાસિક પ્રકાશન

વર્ષ: ૦૧  
અંક: ૦૪-૦૫  
જુલાઈ-ઓક્ટોબર, ૨૦૧૭  
સંખ્યા અંક: ૦૪-૦૫

પેટ્રન : ડૉ. પી. એચ. વાટલીયા તંત્રી : ડૉ. પી. એચ. વાટલીયા સહતંત્રી : ડૉ. એમ. બી. રાજપુત

## અનુક્રમણિકા

ક્રમ	લેખ	પાન નંબર
૧	<b>ગુજરાત રાજ્યમાં બેસની ઓલાદો</b> ડૉ. વી. કે. પટેલ, ડૉ. એમ. બી. રાજપુત અને ડૉ. એ. ડી. ચૌધરી	૧
૨	<b>પશુપાલન થકી મહિલા સશક્તિકરણ</b> ડૉ. એસ. જે. વેકરીયા, ડૉ. એમ. બી. રાજપુત અને ડૉ. પી. એચ. વાટલીયા	૪
૩	<b>દુધાળા પશુઓમાં કષ્ટદાયક વિયાણના કારણો, નિદાન અને ઉપયાર</b> ડૉ. જે. એ. પટેલ, ડૉ. એ. જે. ધામી અને ડૉ. એ. સી. પરમાર	૭
૪	<b>જાનવરોમાં ઉથલા મારવાના કારણો અને તેનું નિવારણ</b> ડૉ. એસ. જે. પટેલ, ડૉ. એમ. ડી. પટેલ અને ડૉ. એમ. બી. રાજપુત	૧૨
૫	<b>પશુઓના આરોગ્યની જગતવણી</b> ડૉ. ડી. બી. સાધુ, ડૉ. મેહુલ પટેલ અને ડૉ. એ. આધ. શાહ	૧૫
૬	<b>કૃષિ અને પશુપાલન દ્વારા સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ અને તેના ફાયદા</b> ડૉ. તન્બીરકાતિમા મોમિન, ડૉ. વિશાલ સુથાર અને ડૉ. ડી.બી.પાટીલ	૧૭
૭	<b>નફાકારક દૂધ ઉત્પાદન - પશુપાલકની ભૂમિકા</b> ડૉ. તન્બીરકાતિમા મોમિન અને ડૉ. વિશાલ સુથાર	૧૯
૮	<b>પશુપાલનમાં પાણીનું મહત્વ</b> ડૉ. આર. એમ. પટેલ અને ડૉ. શ્રીજા પી. રવામી	૨૧
૯	<b>પ્રાણીઓમાં ઓળખની પદ્ધતિઓ અને તેનું મહત્વ</b> ડૉ. એન. બી. ભાટી, ડૉ. એફ. એમ. કાપડિયા અને ડૉ. પી. પી. મકવાણા	૨૪
૧૦	<b>દૂધમાં થતી બેઠસેળ અને તેની રસાયણિક પદ્ધતિ દ્વારા થતી ચકાસણી</b> પ્રો. એ.એસ. હટિયાણી, પ્રો. તન્મય હાજરા અને પ્રો. એ.જે. ડેસીયા	૨૭

નોંધ : “ગૌધૂલિ”માં પ્રગાટ થતા લેખો કામધેનુ યુનિવર્સિટીની માલિકીના છે. આ લેખોમાં દર્શાવેલ અભિપ્રાયો કામધેનુ યુનિવર્સિટીના નથી, પરંતુ જે તે લેખકોના છે. આ લેખોનો “ગૌધૂલિના સૌજન્યથી” એમ ઉત્સેખ કરીને આંશિક કે પૂર્ણત: ઉપયોગ કરી શકાશે. વધુ માર્ગદર્શન માટે સંબંધિત લેખકોનો સંપર્ક કરવો હિંતાવહ રહેશે.

તંત્રી

# ગુજરાત રાજ્યમાં બેંસની ઓલાદો

ડૉ. વી. કે.પટેલ<sup>૧</sup>, ડૉ. એમ. બી. રાજપુત<sup>૨</sup> અને ડૉ. એ. ડી. ચૌધરી<sup>૩</sup>  
૧. પશુઓકિક્ષા અને પશુપાલન મહાવિદ્યાલય સરદારકૃષ્ણનગર  
૨. કામધેનુ ચુનિવર્સિટી, ગાંધીનગર

ગુજરાત રાજ્યમાં બેંસોની મુખ્ય ચાર જાતિઓ છે. મહેસાણી, જાફરાબાદી, સુરતી અને બજી.

## ૧. મહેસાણી



આ ઓલાદ મુરાહ અને સુરતી ઓલાદ ના સંકરણ થી ઉત્પત્ત થયેલ છે. જેથી આ ઓલાદ ના કેટલાક પશુ સુરતી નાં લક્ષણો તથા કેટલાક પશુ મુરાહના લક્ષણો ધરાવે છે. આ ઓલાદ ના પશુઓનો મૂળ વિસ્તાર મહેસાણા બનાસકાંઠા, અમદાવાદ તે મજાબુરકાંઠા જિલ્લો છે.

**બાધ્ય લક્ષણો:-** આ ઓલાદ સુરતી તથા મુરાહ ના મિશ્રિત લક્ષણો ધરાવે છે. આ બેંસો મુરાહ કરતાં કદમાં નાની પણ વધુ લંબાઈ ધરાવતી હોય છે. પશુઓ રંગે કાળા તથા ભૂખરા હોય છે. ચહેરો લાંબો અને સીધો હોય છે. શીંગાં ઈંદ્રોણી આકારથી માંડીને દાતરડા આકારના હોય છે. કેટલાંક પશુઓના માથામાં, પગ અથવા પૂંછદી ઉપર સફેદ રંગ જોવા મળે છે.

**આર્થિક લક્ષણો:-** આ ઓલાદ ના પશુઓ શાંત સ્વભાવના હોય છે. વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૭૦૦ થી ૧૮૦૦ ક્રિ.ગ્રા. તથા દૂધ ના ફેટ રૂથી ૭ થી ૭.૫

ટકા હોય છે. પ્રથમ વિયાણની ઉંમર સરેરાશ ૪૫ થી ૪૮ મહિના હોય છે. બે વિયાણ વચ્ચેનો સરેરાશ સમય ૧૫ થી ૧૬ મહિના હોય છે. વસુકેલો ગાળો ચાર થી પાંચ મહિના હોય છે.

ગુજરાતમાં મહેસાણી ઓલાદ ના ઉંઘેર કેન્દ્રો ૧) પશુ સંસોધન કેન્દ્ર -સરદારકૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી જિ.બનાસકાંઠા

## ૨. જાફરાબાદી



અમરેલી જલ્દાના જાફરાબાદ ગામ આ પશુઓનો મૂળસ્થાપિત વિસ્તાર છે જેથી આ ઓલાદનું નામ જાફરાબાદી રાખેલ છે. આ ઓલાદ નું જન્મસ્થાન ગીરના જંગલોની આસપાસનો વિસ્તાર છે. આ ઓલાદ કાઠીયાવાડી તથા સોરઠી તરીકે પણ ઓળખાય છે. આ ઓલાદના પશુઓ સૌરાષ્ટ્રના બધા જ જલ્દા અમરેલી, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર તથા ભાવનગરમાં જોવા મળેછે.

**બાધ્ય લક્ષણો -** ભારત દેશની બેંસોની બધી ઓલાદોમાં આ ઓલાદના પશુ મોટા કદના, વજનમાં ભારે અને કદાવર હોય છે અને તેથી હાથીના બચ્ચાં તરીકે પણ ઓળખાય છે.

આ ઓલાદ ના પશુઓ ઘાટા કાળા રંગના હોય છે. ચામડી જાડી અને ઓછા વાળ વાળી હોય છે. માથું મોટું અને ઉપસેલા કપાળ વાળું હોય છે. આંખોની પાંપડો મોટી હોવાથી આંખો સંકોચાયેલી લાગે છે. ગરદન જાડી અને પહોળી હોય છે. શીંગડાં ખૂબ જ લાંબાં, ચપટાં, પહોળા અને ભારે હોય છે. શીંગડાં માથા સાથે દબાયેલા પ્રથમ નીચે તરફ વળતા અને દુરના છેદે પૂર્ણ રીંગ બનાવતા હોય છે. કાન મોટા અને લટકતા હોય છે. કાનના મૂળ શીંગડાં પાછળ દબાયેલા હોય છે. પગ મજબૂત પણ લંબાઈમાં થોડા ટૂંકા હોય છે. આ ઓલાદની પુખ્ખ બેંસનું વજન સરેરાશ ૫૪૫ થી ૭૦૦ કિ.ગ્રા. તથા નરનું વજન સરેરાશ ૬૦૦ થી ૭૫૦ કિ.ગ્રા. હોય છે તથા તાજા જન્મેલા બચ્ચાનું વજન ૨૮ થી ૩૧ કિ.ગ્રા. હોય છે.

**આર્થિક લક્ષણો -** આ ઓલાદ દૂધ આપતી નસલ તરીકે સુપ્રસિધ્ય છે. વેતર નું સરેરાશ દૂધ ૨૦૦૦ થી ૨૧૦૦ કિ.ગ્રા. અને દૂધમાં ૧૦ ટકા કરતાં વધારે ફેટ જોવા મળે છે. પ્રથમ વિયાણની ઉંમર ૫૦ થી ૫૫ મહિના તથા બે વેતર વચ્ચેનો સમય ૧૬ થી ૧૮ માસ હોય છે. જે બીજી ઓલાદ કરતાં વધારે હોય છે. વસુકેલો ગાળો ચાર થી ૬ મહિના હોય છે.

**ગુજરાતમાં જાફરાબાદી ઓલાદ નું ઉછેર કેન્દ્ર:**

૧) પશુ સંશોધન કેન્દ્ર - જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જિ. જુનાગઢ

### ૩. સુરતી

આ પશુઓનું ઉદ્ભવસ્થાન ખેડા તથા વડોદરા છે. આ ઓલાદને નડીયાદી, ગુજરાતી તથા ચરોતરી નામે પણ ઓળખાય છે. આ ઓલાદના પશુ અમદાવાદથી સુરત સુધી જોવા મળે છે.

**બાધ્ય લક્ષણો:** આ બેંસો મધ્યમ કદની તથા શરીરે ફાયર આકારની હોય છે. પશુઓનો મુખ્ય રંગ



ભુરાશ પડતો હોય છે. બે સફેદ પણ્ઠા, એક જડબા પાસે અને બીજો આગલા બે પગની નજીક હડા પર ઉપર જોવા મળે છે. પશુઓનું માથું લાંબું અને નાનું તથા આંખો ઉપસેલી હોય છે. શીંગડાં દાતરડા જેવા આકારના હોય છે. કાન મધ્યમ કદના હોય છે. બાવલું મોટું ભરાવદાર અને પાછળની તરફ લંબાયેલું હોય છે. આ ઓલાદની પુખ્ખ બેંસનું વજન સરેરાશ ૪૦૦ થી ૪૫૦ કિ.ગ્રા. તથા નરનું વજન સરેરાશ ૪૫૦ થી ૫૦૦ કિ.ગ્રા. હોય છે તથા તાજા જન્મેલા બચ્ચાનું વજન ૨૫ થી ૨૭ કિ.ગ્રા. હોય છે.

**આર્થિક લક્ષણો:-** આ વર્ગની બેંસોનું દૂધ અને ફેટનું ઉત્પાદન આર્થિક રીતે પોખાય તેવું હોય છે. આ બેંસોનું વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન ૧૨૦૦ થી ૧૫૦૦ કિ.ગ્રા. અને સરેરાશ ફેટ ૭.૫ ટકા હોય છે. બેંસોમાં બે વિયાણ વચ્ચેનું અંતર ૧૫ થી ૧૮ મહિના હોય છે. બેંસોની પ્રથમ વિયાણની ઉંમર ૪૮ થી ૪૮ મહિના હોય છે. વસુકેલો સમય ત થી ૫ મહિના હોય છે. આ ઓલાદની બેંસોનો ખાણ-દાણ તથા નિભાવ ખર્ચ ઘણો જ ઓછો હોવાથી નાના અને સીમાંત ખેડૂતો વધારે પસંદ કરે છે.

**સુરતી ઓલાદ ના પશુઓનું ઉછેર કેન્દ્ર**

(૧) પશુ ઉછેર કેન્દ્ર:- ધામરોલ જિ. સુરત

(૨) પશુ સંશોધન કેન્દ્ર - નવસારી કૃષિ યુનિવર્સિટી જિ. નવસારી

## ૪. બન્ધી

આ ઓલાદ કચ્છ જિલ્લાના બન્ધી વિસ્તારમાં જોવા મળતી હોવાથી આ ઓલાદનું નામ બન્ધી



પાડવામાં આવેલ છે. આ ઓલાદનું સ્થાનિક નામ “કુંડી” છે. આ ઓલાદની શુધ્ય લક્ષણો ધરાવતી ભેંસો મુખ્યત્વે કચ્છ જિલ્લાના ખાવડા, હાજીપીર, નખત્રાણા, લખપત, રાપર અને અબડાસા તાલુકામાં જોવા મળે છે. કચ્છના માલવારી સમાજ માટે આજીવિકાનું મુખ્ય સાધન છે. કચ્છના બદલાતા વાતાવરણ તેમજ દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ટકી રહી શકે છે.



મહેસાણી પાડો

**બાધ્ય લક્ષણો-** આ ઓલાદની ભેંસો મધ્યમથી મોટું કદ અને મજબૂત બાંધો ધરાવે છે. શરીરનો ૮૫ ટકા રંગ કાળો અને પાંચ ટકા રંગ ભૂરો જોવા મળે છે. શીંગડાઓ બહારની બાજુએથી માથા સાથે ૬૦ અંશનો ખૂંઝો બનાવી, ડબલ કુંડળી જેવા ગોળાકાર હોય છે. જેથી બીજી ઓલાદો કરતાં આ ઓલાદ અલગ તરી આવે છે. ચહેરો લાંબો, આંખો તેજસ્વી અને ચમકદાર હોય છે. પગ નાના અને મજબૂત હોય છે. આ ભેંસોનું બાવલું અને આંચળ સુવિકસિત અને સુઠોળ હોય છે.

**આર્થિક લક્ષણો-** આ ભેંસોનું વેતરનું કુલ દૂધ ઉત્પાદન ૧૮૦૦ થી ૨૦૦૦ કિ.ગ્રા હોય છે. આ ભેંસો વિયાળમાં નિયમિત હોય છે. આ ભેંસોની પ્રથમ વિયાળની ઊંભર ૪૦ થી ૪૫ મહિના હોય છે. બે વિયાળનો સમયગાળો ૧૨ થી ૧૪ મહિના હોય છે. વસુકેલ સમયગાળો બે થી ચાર મહિના હોય છે.

ગુજરાતમાં બન્ધી ઓલાદ ના ઉછેર કેન્દ્રો

૧) બન્ધી ભેંસ સંવર્ધન કેન્દ્ર-ભૂજ જિ. કચ્છ



સુરતી પાડો

# પશુપાલન થકી મહિલા સરક્કિતકરણ

ડૉ. એસ. જે. વેકરીયા<sup>૧</sup>, ડૉ. એમ. બી. રાજપુત<sup>૨</sup> અને ડૉ. પી. એચ. વાટલીયા<sup>૩</sup>  
૧ મદદનીશ પ્રાધાપક, ૨ પશુ ચિકિત્સા અધિકારી, ૩. કુલપતિશ્રી અને વિસ્તરણ નિયામકશ્રી  
કામધનુ ચુનિવર્સિટી, ગાંધીનગર

ભારત દેશની અર્થવ્યવસ્થા ફૂષિ અને પશુપાલન પર આધારિત છે. ખેતી અને પશુપાલન એકબીજાના પુરક છે. ભારતમાં આશરે ૭૦ % લોકો ગામડાઓમાં વસે છે, જેઓ મહદુંઘંશે ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ખેતી અને પશુપાલનનો ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ઘણો જ મહત્વનો ફાળો રહેલો છે. ઘણા પરિવારોમાં પશુપાલનની આવક ખેતીની આવકની સરખામણીમાં ઘણી વધારે છે. ઘરકામની સાથે પશુપાલનનું કાર્ય કરી મહિલાઓ ઘરની આવકમાં વધારો કરી કુટુંબને સુખાકારી આપે છે. એક અહેવાલ પ્રમાણે પશુપાલનમાં આશરે ૬૦-૭૦% કાર્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ચારાની કાપડી, ચારાને નીરવો, ખોરાક અને પાણી આપવું, પશુઓના રહેઠાણની સ્વચ્છતા તેમજ પશુઓની સફાઈ અને દૂધ દોહન તથા વેચાણનો સમાવેશ થાય છે.

પશુપાલન થકી મહિલાઓને ઘર ચલાવવામાં આર્થિક સહાય મળી રહે છે. ગામડાઓમાં બાળાઓને નાનપણથી જ પશુપાલન વ્યવસાયની તાલીમ મળે છે. આ બાળાઓ મોટી થઈને સાસરે જાય ત્યારે ત્યાં પશુપાલન થકી કુટુંબને સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. આપણો દેશ વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ટોચ પર છે, પરંતુ જાનવરનું માથાદીઠ દૂધ ઉત્પાદન ઓછું છે, તેથી જાનવરના માથાદીઠ દૂધ ઉત્પાદન તથા ગુણવત્તામાં સુધારાનો અવકાશ રહેલ છે. જો આવકત તથા સુઝબુઝથી પશુપાલનનો વ્યવસાય કરવામાં આવે તો ઉત્પાદન વધારીને વધારાની આવક મેળવી ઘણો ફાયદો કરી શકે એમ છે. જો મહિલાઓ પશુપાલનમાં

વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો પશુપાલનના વ્યવસાયમાં કાંતિ લાવી શકાય એમ છે.

## પશુપાલન જ શા માટે ?

- પશુપાલન વ્યવસાયમાં ભારે રોકાણની જરૂર પડતી નથી. પશુપાલક મહિલાઓ એક-બે દેશી ગાયો કે બેંસો થકી વ્યવસાય શરૂ કરી શકે છે.
- દેશી પશુઓનો નિભાવ બર્ચ ઓછો આવે છે કેમ કે આ પશુઓને ખેતીની આડપેદાશો પર તથા શેઢા પાળાના ઘાસચારા કે નિંદામણ અને થોડા-ઘણાં પ્રમાણમાં ઘાસચારો પેદા કરીને સરળતાથી નિભાવી શકાય છે.
- પશુપાલન વ્યવસાયમાં મજૂરોની સતત જરૂરિયાત રહેતી નથી, આથી મહિલાઓ પોતાના રોજિંદા કામની સાથે પશુપાલનને પુરક વ્યવસાય તરીકે અપનાવી શકે છે.
- પશુપાલન વ્યવસાયમાં મજૂરોની સતત જરૂરિયાત રહેતી નથી, આથી મહિલાઓ પોતાના રોજિંદા કામની સાથે પશુપાલનને પુરક વ્યવસાય તરીકે અપનાવી શકે છે.
- પશુપાલન થકી મળતા દૂધની સ્થાનિક બજારમાં પણ માંગ રહે છે, આ ઉપરાંત દૂધમાંથી બનાવેલ વિવિધ ઉત્પાદનોની પણ બજારમાં સારી કિમત મળી રહે છે.
- ગામડાની મહિલાઓ માટે પશુપાલન એ રોજિંદી સતત આવકનો સ્વોત છે.
- પશુપાલન થકી દૂધની સાથે ખેતી માટે ફળદુપ ખાતર તથા રસોડા માટે ઉપયોગી બાયોગેસ મળી રહે છે. આનાથી ખેતીમાંથી સારી ઉપજ મેળવી શકાય છે અને રસોડામાં થતો લાકડાનો ઉપયોગ

- ઓછો કરી વૃક્ષોનું છેદન અટકાવી શકાય છે.
- સમગ્ર ગુજરાતમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ વ્યાપક પ્રમાણમાં વિકસી હોવાથી દૂધના વેચાણ કે વિતરણની સમસ્યા નથી.

પશુપાલન થકી મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ છે. તેરી ઉદ્ઘોગની સહાયથી ગ્રામીણ બેન્કોમાં ખાતા ખોલાવી મહિલાઓ સ્વનિર્ભર બની છે અને પોતાના પરિવાર તથા બાળકોના અભ્યાસમાં મદદરૂપ સાબિત થઈ છે. દૂધ ઉત્પાદન તથા ગુણવત્તા સુધારવા માટે મહિલાઓને તાલીમ આપીને સક્ષમ બનાવવીએ તે મહત્વનું પાસું છે. મહિલા પશુપાલકો પશુઓના આહાર, તેનું મહત્વ, પશુઓની કાળજી તે મજ વ્યવસ્થાપન, પશુઓના સામાન્ય રોગો તથા તેને અટકાવવાના ઉપાયો જેવા વિધયો પર તાલીમ મેળવી વૈજ્ઞાનિક સમજ કેળવેએ અગત્યનું છે.

ગુજરાત રાજ્યમાં મોટા ભાગના ગામડાઓમાં સહકારી દૂધ મંડળીઓ આવેલી છે જેમાંની ઘડી મંડળીઓ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા જ ચલાવવામાં આવે છે. મહિલા દૂધમંડળીઓમાંથી અમુક મંડળીઓ સૌથી વધુ દૂધ ભરાવતી મંડળી તરીકેનાં પુરસ્કાર પણ મેળવી ચૂકેલ છે. દૂધ ઉત્પાદનના સહકારી માળખાને લીધે ગુજરાત રાજ્યમાં ફેનિક ૧૮૦ લાખ લીટર કરતા પણ વધુ દૂધ એકત્રિત કરી પ્રોસેસ કરવામાં આવે છે. દૂધ ઉત્પાદનમાં મહિલાઓનો ખુબ જ ફાળો રહેલો છે. માટે, મહિલા સશક્તિકરણના યુગમાં ગામડાની મહિલાઓની સામાજિક તેમજ આર્થિક સધ્યરતા પશુપાલન વ્યવસાય પર નિર્ભર છે એમ કહેવું યોગ્ય ગણાશે.

પ્રાંતીજ તાલુકાના ગીતાબેન દશરથભાઈ પટેલ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે

પશુઓ પ્રત્યે ખાસ રૂચિ હોવાથી પશુપાલનને જ સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવવાનો નિર્ણય કર્યો. વર્ષ ૨૦૧૦-૧૧ માં ૩૦ ગાયોથી ઉત્પાદનની શરૂઆત કરી અને પ્રથમ વર્ષથી જ સફળતાના શિખરો સર કરતા ગામમાં અને તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે તેમણે વિવિધ અધિકારીઓની મુલાકાત લીધી. આધુનિક પદ્ધતિથી દૂધ ઉત્પાદન કરવા ૧૫૦ ગાયોને વસાવી અને આધુનિક તબેલો બનાવ્યો. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી ઉચ્ચ દૂધ ઉત્પાદન મળતા તેમની કમાણી બમણી થઈ. આ સિદ્ધિને બિરદાવવા તેમને રાજ્ય કક્ષાનો વર્ષ ૨૦૧૨-૧૩ નો ‘બેસ્ટ આત્મા ઐડ્રોટ એવોર્ડ’ આપી સન્માનવામાં આવ્યા. વર્ષ ૨૦૧૨-૧૩ માં ગીતાબેનને પશુપાલન વ્યવસાયમાંથી રૂ. ૨૧.૩૬ લાખનો નફો થયેલ છે.

આ ઉપરાંત ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં મહિલાઓએ દૂધ ઉત્પાદનમાં અવ્યાખ્યાત સ્થાન પ્રાપ્ત કરી પુરસ્કૃત થયેલ જેની યાદી નીચે મુજબ છે. (૨૦૧૭)

ક્રમ	નામ	નંબર	જલ્લો
૧	દિમીબેન અશ્વિનભાઈ પટેલ	પ્રથમ	ખેડા
૨	કાજુબેન રાવતાભાઈ માળવી	પ્રથમ	બનાસકાંઠા
૩	દેવીબેન માંઝાભાઈ મોઢવાડિયા	પ્રથમ	દેવભૂમિ દ્વારકા
૪	ચંચળબેન દશરથસિંહ પરમાર	પ્રથમ	ગોધરા
૫	વનીતાબેન કમલેશભાઈ ચૌથરી	પ્રથમ	ડાંગ

પશુપાલન વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારીએ ગ્રામીણ કક્ષાએ સ્થિતી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. પશુપાલનમાં મહિલાઓની વિવિધ બાબતોમાં ભાગીદારી અંગેના એક અભ્યાસનાં આંકડાઓ નીચે રજૂ કર્યાછે.

પશુપાલન વ્યવસ્થાપનમાં મહિલા ભાગીદારી :

(કુલ સંખ્યા - ૧૫૦)

ક્રમ	કામકાજ	સંખ્યા	ટકાવારી
૧	નવજાત બચ્ચાની કાળજી લેવી	૧૫૦	૧૦૦%
૨	બચ્ચાનું ધાવણ છોડાવી કાળજી લેવી	૧૦૦	૬૬.૬૬%
૩	પશુઓમાં દૂધ દોહન	૧૦૫	૭૦%
૪	પશુઓનાં રેકર્ડની જાળવણી	૨૦	૧૩.૩૩%
૫	પશુ જગ્યાની સાફ સફાઈ	૧૫૦	૧૦૦%
૬	દૂધ દોહનનાં વાસણાની સાફ સફાઈ	૧૫૦	૧૦૦%

૨. દૂધાળ પશુઓને આહાર આપવામાં મહિલા ભાગીદારી : (કુલ સંખ્યા-૧૫૦)

ક્રમ	કામકાજ	સંખ્યા	ટકાવારી
૧	પશુઆહાર તૈયાર કરવો	૧૦૪	૬૮.૩૩%
૨	ધાસચારાના ટુકડા કરવા	૧૦૦	૬૬.૬૬%
૩	પશુદાશ આપવું	૧૩૦	૮૬.૬૬%
૪	લીલા ધાસચારાની કાપણી કરવી	૮૮	૬૫.૩૩%
૫	બચ્ચાઓને આહાર આપવો	૧૪૦	૮૩.૩૩%
૬	પશુઆહારનો સંગ્રહ કરવો	૧૪૫	૮૬.૬૬%
૭	પશુઓને પાણી આપવું	૧૩૫	૮૦%
૮	લણની કરેલ ધાસચારાને લાવવો	૮૦	૬૦%

૩. પશુ સંવર્ધનની કામગીરીમાં મહિલા ભાગીદારી : (કુલ સંખ્યા - ૧૨૦)

ક્રમ	કામકાજ	સંખ્યા	ટકાવારી
૧	પશુને ફૂન્ઝિમ બીજદાન માટે લઈ જવું	૮૪	૭૮.૩૩%
૨	પશુને પાડા/સાંદ જોડે લઈ જવું	૮૩	૬૮.૧૬%
૩	પશુને ગર્ભપરિક્ષણ માટે લઈ જવું	૧૦૮	૮૦.૮૩%
૪	વિયાણ દરમિયાન ચીજવસ્તુઓ એકઠી કરવી	૮૧	૬૭.૦૫%
૫	વિયાણ તકલીફ સમયે પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો	૮૮	૭૩.૩૩%

૪. પશુ આરોગ્ય જાળવણીમાં મહિલા ભાગીદારી : (કુલ સંખ્યા - ૧૨૦)

ક્રમ	કામકાજ	સંખ્યા	ટકાવારી
૧	બીમાર પશુની કાળજી	૧૦૪	૮૬.૬૬%
૨	નવજાત વાઇરસી/પાડીની કાળજી	૧૦૭	૮૮.૧૬%
૩	ગાભણ પશુની માવજત	૧૧૦	૮૧.૬૬%
૪	પશુને સારવાર માટે લઈ જવું	૮૮	૮૨.૦૫%
૫	પશુને રસી અપાવવી	૮૫	૭૮.૧૬%

ઉપર જણાવેલ આંકડાઓ પરથી મહિલાઓનાં પશુપાલનમાં ઉમદા યોગદાનની પ્રતીતિ થશે. જો બધી મહિલાઓ પશુપાલનને વૈજ્ઞાનિક ઢબે અપનાવતી થાય તો આ વ્યવસાયમાંથી ગ્રામીણ સમૃદ્ધિ આવી શકે એમ છે અને પ્રત્યેક ગામ તેમજ પ્રત્યેક કુટુંબ સામાજિક અને આર્થિક રીતે સધ્યર બની શકે એમ છે.

# દુધાળા પશુઓમાં કષ્ટદાયક વિયાણના કારણો, નિદાન અને ઉપચાર

ડૉ. જે. એ. પટેલ, ડૉ. એ. જે. ધામી અને ડૉ. એસ. રી. પરમાર  
ગાયનેકોલોજી વિભાગ, વેટરનરી કોલેજ, આણંદ કૃષ્ણ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૦૦૧

હાલના હરિયાળી અને શ્વેત કાંતિના યુગમાં આપણી ગાયો-ભેંસો નિયમિત ૧૨ થી ૧૪ માસ અડચણ રહિત વિયાય અને વિયાણ બાદ ૨ થી ૪ માસમાં ફરી વેતરે આવી સગર્ભ થાય તે અતિ આવશ્યક છે. ગાયો અને ભેંસોમાં સરેરાશ ગાભણકાળ અનુક્રમે ૨૮૦ તથા ૩૧૦ દિવસનો હોય છે. આ સમય પુરો થતાં બચ્ચાનો જન્મ થાય છે. આ કિયાને પ્રસવ અથવા વિયાજણ કહેવામાં આવે છે. જો આ પ્રક્રિયા કુદરતી રીતે ન થાય અને તેમાં તકલીફ પડે તો તેને કષ્ટદાયક વિયાણ કે કઠિન પ્રસવ કહે છે. જેનું પ્રમાણ ૩ થી ૪ ટકા જેટલું હોય છે.

## સામાન્ય પ્રસવની કિયા:

સગર્ભવસ્થાના અંત સમયે માદા પ્રસવની કિયા દ્વારા બચ્ચાને ગાર્ભશયમાંથી બહાર લાવે છે. પ્રસવનો પ્રારંભ કેટલાક જટીલ કારણોને લઈને થાય છે. જેવાં કે (૧) યાંત્રિક ઉદ્દીપન: જેમ કે ગાર્ભશય અને ઉદરગુહામાં દબાણ બધતાં બચ્ચાને અકળામણ થવી, અને કોટીકોસ્ટીરોઇડ અંતઃખાવ ઝરવો, (૨) અંત: ખાવી કિયાઓ: જેમાં પ્રારંભમાં ગાર્ભશયના સ્નાયુઓનું ઈસ્ટ્રોજન અને ઓકિસટોસીન અંતઃખાવોને લીધે સંકોચન થવું. (૩) પ્રતિરક્ષા વિજ્ઞાનને લગતી કિયાઓ: એટલે કે ગર્ભાવરણોની ગાર્ભશયથી છૂટા પડવાની કિયા વગેરેનો સમાવેશ થાય છે. પ્રસવનું કાર્ય ઘણું જ કઠિન હોય છે. પ્રસવ/વિયાણની કિયાને મુખ્યત્વે ત્રણ તબક્કામાં વર્ણવી શકાય, જેમકે (૧) ગાર્ભશયમુખ કે કમળ ખુલવું

અને યોનિમુખે જળથેલી/પરપોટો દેખાવાનો તબક્કો, (૨) ગાર્ભશય સ્નાયુ સંકોચન અને અભેલાને લઈ બચ્ચું બહાર આવવાનો તબક્કો, અને ત્યારબાદ (૩) મેલી/ઓર/જર પડવાનો તબક્કો. ગાય-ભેંસમાં આ ત્રણે તબક્કાની સરેરાશ સામાન્ય અવધિ અનુક્રમે ૩.૦ થી ૫.૦ કલાક, ૧.૫ થી ૨.૦ કલાક અને ૬.૦ થી ૮.૦ કલાક જેટલી હોય છે. કઠિન પ્રસવના કિસ્સમાં મોટેભાગે પ્રથમ અને/અથવા બીજા તબક્કાની અવધિ સરેરાશ કરતાં બમણી કે તેથી વધુ લંબાય જાય છે.

સગર્ભ તથા પ્રસવકાલીન પ્રાણીઓમાં ઉભી થતી આવી મુશ્કેલીઓની સારવાર જો સમયસર ન કરવામાં આવે તો ઘણાં કિસ્સાઓમાં બચ્ચું તથા માદા બન્નેને ગુમાવવા પડે છે. પશુચિકિત્સા સારવારના કેસોમાં ૬-૧૦ ટકા કેસો સગર્ભ તથા પ્રસવકાલીન પરિસ્થિતીને લગતા હોય છે. જેવાં કે સગર્ભવસ્થા દરમ્યાન યોનીભંશ, પ્રસવ પદ્ધીનો યોનીભંશ, ગર્ભની પ્રસુતિ, આસન અને સ્થિતિની અસમાનતાઓ ને લીધે તથા અન્ય કારણો ને લીધે થયેલ કઠિન પ્રસવ, ગાર્ભશય વિમોટન કે આંટી પડવાને લીધે કઠિન પ્રસવ ગર્ભપાત, ઓર અવરોધ વિગેરેને લઈ પ્રસવ વખતે કયારેક મુશ્કલી ઉભી થાય છે અને બચ્ચું માદાના પ્રયાસો છતાં જન્મી શકતું નથી અને તેને સમયસર મદદ/સારવારની આવશ્યકતા ઉભી થાય છે. કષ્ટદાયક વિયાણના કારણોમાં માતા સંબંધિત (૨૫%) અને બચ્ચા સંબંધિત (૭૫%) એમ બે મુખ્ય પ્રકારના કારણો હોય છે.

## કષ્ટદાયક વિયાણના મુખ્ય કારણો:

- (અ) માતા સંબંધિત કઠિન પ્રસવના મુખ્ય કારણો:
- (૧) માદા જનનાંગોની સંકીર્ણતા
  - (૨) ગભર્શયના સ્નાયુ ઓની શિથિલતા
  - (૩) અંતખાવોની ખામી ઓ
  - (૪) વારસાગત કારણો
  - (૫) ગભર્શયની આંતી
  - (૬) ગભર્વિરણોની જલમયતા
  - (૭) કમળનું નખુલવું
  - (૮) વધારે પડતી ઉભરતથા શરીરની નબળાઈ
  - (૯) યોનિમાર્ગમાં ગાંઠ, ચરબી જામવી
  - (૧૦) નિતંબના હાડકાંનું ફેકચર અને અયોગ્ય ગાંઠન, વિગેરે
- (બ) બચ્ચા સંબંધિત કઠિન પ્રસવના મુખ્ય કારણો:
- (૧) બચ્ચાની પ્રસ્તુતી, આસનના દોષો
  - (૨) બચ્ચાની ગરદન, શીર્ષ તથા પગની સ્થિતિના દોષો
  - (૩) અતિકાય અને રાક્ષસી ગર્ભ
  - (૪) જોડીયા કે મૃત ગર્ભ
  - (૫) અધુરા માસે પ્રસવ, વગેરે

## નિદાન અને સારવારની પદ્ધતિ:

### ૧. પ્રસવકાલીન પ્રાણી અંગો માહીતી મેળવવી

કષ્ટદાયક વિયાણના કારણો અને બચ્ચાની સ્થિતિ અને તે જીવિત છે કે મૃત છે. તે જીણવા માટે પણુપાલકે પણુ ચિકિત્સકને નીચે મુજબના પ્રશ્નોના ડકીકત લક્ષી સાચા જવાબો આપવાના હોય છે.

- (૧) સગર્ભાવસ્થાકાળ પુરો થયો છે કે નહીં?
  - (૨) પ્રાણી પ્રથમ વખત વિયાય છે કે વધુ વખત વિયાયેલ છે?
  - (૩) વધુ વખત વિયાયેલ હોય તો આગળના વિયાજણો વખતે કાંઈ તકલીફ ઉભી થયેલ હતી કે નહીં?
  - (૪) સગર્ભાવસ્થા દરમ્યાન સગર્ભ પ્રાણીની યોગ્ય માવજત તથા સંભાળ લેવામાં આવી હતી કે નહીં?
  - (૫) પ્રાણી ઉદરપીડા કયારે શરૂ થઈ? તેણે કયારે ચુંકાવું શરૂ કર્યું? તે સૌચ્ચ અને આંતરે આંતરે ચુંકાતું હતું કે પ્રબળ રીતે વારંવાર ચુંકાતું હતું?
  - (૬) પ્રાણીએ ચુંકાવું બંધ કર્યું છે કે ચુંકાવાનું ચાલુ છે?
  - (૭) જલથેલી/ પરપોટા દેખાયેલ છે કે નહીં? દેખાયેલ હોય તો કયારની દેખાય છે?
  - (૮) ભગદ્વારા જનન અવયવોમાંથી પ્રવાહી વહી જતું દેખાયું છે કે નહીં?
  - (૯) બચ્ચાનો કોઈ ભાગ ભગોછ વચ્ચે દેખાયો હતો કેમ?
  - (૧૦) કોઈએ બચ્ચાનો પ્રસવ કરાવવા પ્રયાસ કરેલ છે કે નહીં?
  - (૧૧) બહુપ્રસુ પ્રાણીઓમાં એકાદ બચ્ચાનો જન્મ થયો છે કે નહીં?
  - (૧૨) પ્રાણી ખોરાક લેછે કે નહીં?
- પણુ ચિકિત્સકે સચોટ નિદાન અને સમયસર યોગ્ય સારવાર માટે ઉપરના અને એવા જ બીજા અનેક પ્રશ્નો પુછી કઠિન પ્રસવના કિસ્સાઓ અંગે ઘણી

માહિતી મેળવવી આવશ્યક હોય છે. જો પ્રસવની શરૂઆત થયે અમુક કલાક જ થયા હોય ત્યારે અને પ્રાણી સૌભ્ય રીતે આંતરે ચુંકાતુ હોય તો મોટે ભાગે પ્રસવનો દ્વિતીય તબક્કો શરૂ થયો હોતો નથી. જો ઉદર પીડા પ્રબળ હોય અને લાંબો સમય થવા છતા બચ્યાનો જન્મ થયો ન હોય તો કંઈક અવરોધને લીધે આમ બનતુ હોવુ જોઈએ એમ માની શકાય. પ્રસવની શરૂઆત થયે ૨૪ કલાક કરતાં વધુ સમય થઈ ગયો હોય તો બચ્યાનું મુત્યુ થયુ હશે એમ ધારી શકાય. પ્રથમવાર વિયાતી વોડકીઓ- પાડીઓ અને કુતરીઓમાં ઘણીવાર કઠિન પ્રસવનું કારણ સામાન્ય હોય છે. સહેજ અતિકાય બચ્યું હોવાને લીધે પ્રસવ થયો હોતો નથી. આવા ડિસ્સાઓમાં પરપોટો/જલથેલી બહાર દેખાઈ હોય છે. તેમજ પ્રાણી વારંવાર ચુંકાતુ હોય છે. ઘોડીમાં પ્રસવનો દ્વિતીય તબક્કો ૩૦ મીનીટ જેટલો ટૂંકો હોય છે, જેને લીધે ગર્ભિવરણો તથા ગર્ભિશય વચ્ચેનું બંધન વહેલુ તુટી જાય છે. આથી ઘોડીમાં તબક્કો લંબાઈ જાય તો બચ્યાનું પ્રાણવાયુના અભાવને લીધે મુત્યુ થાય છે. બીજા પ્રાણીઓમાં પ્રસવનો દ્વિતીય તબક્કો એટલો પ્રબળ કે ઝડપી હોતો નથી. તેમજ ગર્ભિવરણો પણ ઝડપથી છુટા પડતા નથી. આથી બચ્યું જલ્દી મુત્યુ પામતુ નથી. લાંબા સમયના કઠિન પ્રસવના ડિસ્સામાં પ્રાણી ચુંકાતુ હોય છે, ગર્ભિવરણોમાંનું પ્રવાહી વહી ગયુ હોય છે, માદા ચુંકાઈને થાકી જાય છે અને બચ્યું મુત્યુ પાખ્યુ હોય છે અને લાંબો સમય વીતી જવાને કારણે તેમાં ચેપી જીવાણુંઓનું પ્રમાણ વધી ગયુ હોય છે કે કયારેક બચ્યું ફુલી પણ ગયું હોય છે.

## ૨. માદા જાનવરની બાબ્ય તપાસ

પશુ ચિકિત્સકે નીચે જણાવેલ પ્રશ્નોત્તરી બાદ જાનવરને બહારથી તપાસવાનું હોય છે. જાનવર ઉભુ

છે કે આંદું પડેલ છે ? તે પ્રસવના પ્રયાસો દરમ્યાન થાકી ગયું છે કે કેમ ? તેના શરીરનું ઉષ્ણતાપમાન, નાડીના ધબડારા અને શ્વાસોશ્વાસ કેવા છે ? તેના યોનિમાર્ગમાંથી તાજૂ લોહી પડે છે કે દુર્ગધ મારતો ખાવ પડે છે ? યોનિમાર્ગ સોજાના તથા ઈજાઓ થવાના ચિન્હો જણાય છે કે કેમ ? ભગમાંથી જલથેલી કે ગર્ભિવરણોના ભાગ દેખાય છે કે કેમ ? બચ્યાનો કોઈ ભાગ બહાર દેખાય છે ? માતાના પેટનો ભાગ વધારે પડતો મોટો દેખાય છે ? એટલે કે ગર્ભિવરણો જલશોથ, જોડીયા બચ્યા અગર આફરો થયા અંગે અવલોકન કરી અનુમાન કરવાનું હોય છે.

## ૩. યોનિમાર્ગતપાસ

કઠિન પ્રસવની સારવાર દરમિયાન પશુ ચિકિત્સકે પશુ ઉપરાંત પોતાના માટે જરૂરી સાવચેતી રાખવી જરૂરી છે. જેવી કે એપ્રોન, ગમબુટ તથા રબરના હાથ મોજા પહેરવા. પશુપાલકે પણ પુરતા પ્રમાણમાં ગરમ પાણી તૈયાર રાખવું જરૂરી છે. જો જાનવર ઉભુ હોય તો તપાસ તથા સારવાર કરવામાં સરળતા રહે છે. પરંતુ આંદું પરી ગયેલ હોય તો તેને ઈલેક્ટ્રીક સ્ટીભ્યુલન્ટ અથવા અન્ય રીતે ઉભુ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આમ છતાં જાનવર ઉભુ ન થાય તો પાછળનો ભાગ રેતી, ભુસુ અથવા ઘાસચારાના ભરેલા કોથળા મૂકી ઉચ્ચો કરવો જોઈએ. જાનવર વધારે પડતું ચુંકાતું હોય તો પૂંછદીના ભાગે એનેસ્થેસીયા આપી પાછળનો ભાગ બહેરો કરવો જરૂરી હોય છે. પશુનું યોગ્ય રીતે નિયત્રણ કરી પ્રાણીના પશુભાગ તથા ભગોળને સાખુ તથા પાણી વડે સાફ કરી યોનિમાર્ગ તથા ગર્ભિશય ગ્રીવાની તપાસ કરવામાં આવે છે. બચ્યું જીવંત છે કે નહી તે જાણવા માટે તેના મોઢામાં કે નાકમાં આંગળી નાખી જડબું હલાવે છે કે નહી તે તપાસવામાં આવે છે. બચ્યાની આંખને આંગળી વડે દબાવવાથી તે હલચલ

કરે છે કે નહીં, અથવા પગને પકડી ચુંટી ભરવાથી તે પગ પાછો ખેચી લે છે કે કેમ તે નોંધવામાં આવે છે. જો બચ્ચાનો પચ્છભાગ જનમાર્ગમાં દાખલ થયો હોય, એટલે કે તે ઉલટી સ્થિતિમાં હોય, તો તેના મળદ્વારામાં આંગળી નાખવાથી મળદ્વારાના સ્નાયુઓનું સંકોચન થતું જણાય છે. જો બચ્ચું સડી ગયેલ હોય તો તેના વાળ સહેલાઈથી નીકળી આવે છે. બચ્ચાની કાળજીપુર્વક તપાસ કરી તેની પ્રસ્તુતિ, આસન તથા સ્થિતી સામાન્ય છે કે કેમ તે નક્કી કરવામાં આવે છે. તેનું કદ જનનમાર્ગમાંથી પસાર થઈ શકે તેમ છે કે કેમ તેનું પણ અનુમાન લગાવવામાં આવે છે. બચ્ચાનો અગ્રભાગ જનનમાર્ગમાં દાખલ થયો હોય તો તેના આગલા પગ, માથું, કાન અને ગરદનની હયાતી જનનમાર્ગમાં માલુમ પડે છે. જો બચ્ચાનો પચ્છભાગ જનનમાર્ગમાં દાખલ થયેલ હોય તો જનનમાર્ગમાં પુંછડી તથા પાછલા પગ જણાઈ આવે છે. રાક્ષસી ગર્ભની સ્થિતિમાં આગલા પગ બેવડાય છે અને શરીરના સ્નાયુ પાતળા હોય છે. બને પગ આગળના કે પાછળના છે અથવા એક પગ આગળનો અને બીજો પાછળનો છે તે તપાસી નક્કી કરવું આવશ્યક હોય છે.

#### ૪. પ્રસવ પ્રક્રિયા અને પરિણામ


પ્રસ્તુતી, આસન અને સ્થિતિની ખામીઓ વાળા બચ્ચાં કઠિન પ્રસવના કિસ્સાઓ માટે જવાબદાર હોય છે. આવી પરિસ્થિતિમાં પ્રસ્તુતિ, આસન અને સ્થિતિના દોષોને પ્રતિકર્ષણ, ઉત્પરિવર્તન અને દોષ નિવારણની કિયાઓ દ્વારા દૂર કરી, એટલે કે બચ્ચાને ગર્ભશયમાં પાછું ધકેલી જરૂર મુજબ ફેરવી પાછળ વળી ગયેલ માથું/ઊંઠ કે પગ સીધા કરી, તેને સામાન્ય પ્રસ્તુતિ, આસન અને સ્થિતિમાં લાવી બચ્ચાનો પ્રસવ કરાવી શકાય છે.

જ્યારે બચ્ચુ જીવતુ હોય ત્યારે ખૂબ સાવચેતી ભરી રીતે આ કિયાઓ કરવી પડે છે. આ માટે પ્રસવ માટેના આંકડા કે હુકનો ઉપયોગ કરી શકાય છે. અતિકાય ગર્ભની કે વાતસ્કૃતિ/હુકી ગયેલ ગર્ભની સ્થિતીમાં જો પ્રસ્તુતી, આસન અને સ્થિતીના દોષો ન હોય તો બે વ્યક્તિત્વાની ખેડું (કર્ષણ આપી) આવા બચ્ચાનો પ્રસવ કરાવી શકાય છે.


જ્યારે ગર્ભનું કદ ખૂબ જ મોટુ હોય કે જેથી કર્ષણ દ્વારા કે ખેડુને તેનો પ્રસવ શક્ય ન હોય તેમજ જ્યારે કુપ્રસ્તુતિ નિવારવી અને સુધારવી શક્ય ન હોય ત્યારે ગર્ભછેદનનો આશરો લેવો પડે છે. ગર્ભછેદન દ્વારા બચ્ચાના એ કે બે ઉપાંખો કાપી તેનું કદ ઓછું કરી પછી ખેડું/કર્ષણ આપી પ્રસવ કરાવાય છે. આ માટે જરૂરી ડિઝાઇનવાળા સાધનો જેવાં કે હુક, ચિપિયો, ચઘ્પુ, ચેન, તથા લુબ્રીકન્ટ તરીકે તેલ, સાબું, કાબોકસી મીથાઈલ સેલ્વુલોજ વિગેરે વાપરવામાં આવે છે. આ સમય દરમ્યાન પશુચિકિત્સકના હાથને અથવા યોનિમાર્ગ તથા ગર્ભશયને નુકસાન થાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. મોટા પ્રાણીઓમાં પેટ કાપી સીજેરીયન પ્રસવ કરાવવા કરતા ગર્ભછેદન વધુ સારુ પરિણામ આપે છે. જો સીસ્ટોઝોમસ રીફલેક્શન્સ, પેરોઝોમસ એલમ્બીસ કે એવા બીજા કોઈ પણ પ્રકારના રાક્ષસી ગર્ભને લીધે કઠિન પ્રસવની સ્થિતી ઉત્પન્ન થઈ હોય તો આંશિક ગર્ભછેદન કરવાની જરૂર રહે છે. પરંતુ જ્યારે બચ્ચાની જીંદગી બચાવવાની હોય ત્યારે સીજેરીયન પ્રસવ કરાવવો ઉચ્ચીત છે. સીજેરીયન ઓપરેશન વખતે બચ્ચું બહાર કાઢ્યા બાદ શક્ય હોય તો ઓર પણ દૂર કરવામાં આવે છે. અને ઓપરેશન બાદ ૫ થી ૭ દિવસ સુધી ચેપ અટકાવવા પ્રતિજ્ઞૈવિક તથા દુખાવો ધટાડવા

એનાલ્જેસીક દવાઓ આપવામાં આવે છે. જેથી જાનવરની તબિયત જળવાઈ રહે, દુધ ઉત્પાદન વહેલું અને સારુ મળો તથા પશુને ફરીથી ગાભજા થવામાં કોઈ તકલીફ રહે નહીં.


કઠિન પ્રસ્તુતા કિસ્સામાં જેટલું વહેલું અને સચોટ નિદાન થાય અને સમયસર સારવાર થાય તેટલું પરિણામ હકારાત્મક સારુ મળતું હોય, પશુ પાલકો આ દિશામાં જાગૃકતા કેળવે તે તેમના અને તેમના પશુના હિતમાં છે.



વિયાષા સમયે બચ્ચાની સામાન્ય પ્રસૂતિ, આસન અને સ્થિતિ



બચ્ચાની અગ્રવર્તી પ્રસૂતિમાં અસામાન્ય આસન અને સ્થિતિ



બચ્ચાની પશ્ચાદવર્તી પ્રસૂતિમાં અસામાન્ય આસન અને સ્થિતિ

# જાનવરોમાં ઉથલા મારવાના કારણો અને તેનું નિવારણ

ડૉ. એસ. કે. પટેલ<sup>૧</sup>, ડૉ. એમ. ડી. પટેલ<sup>૧</sup> અને ડૉ. એમ. બી. રાજ્પતુ<sup>૨</sup>

૧. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા, જી. પાટણ

૨. કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર

ગાય-ભેંસોમાં ઉથલા મારવા એ અગત્યનો પ્રશ્ન છે જેના લીધે દુધાળા જાનવરોના ઉત્પાદન માં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. ગાય-ભેંસના લગભગ નિયમિત ૧૭ થી ૨૪ દિવસના ઋતુચક દરમિયાન સાંધ કે પાઢાથી આશરે ત્રણ-ચાર વખત કુદરતી રીતે ફેળવ્યા છતાં ગર્ભન રહેતા, ફરીથી ગાય-ભેંસ ગરમી/વેતરમાં પછી ફરે છે, જેને ઉથલા મારવાનું કહે છે. ઉથલા મારવા અંગે જુદા જુદા તજજોઓ અભ્યાસ કરેલ તે અનુસાર ૧૦ ટકા થી ૫૦ ટકા જેટલી ઉથલા મારવાની સંભાવના ગાય-ભેંસો માં જોવા મળેલ છે.

## મુખ્ય પાસાઓ:

દુધાળા જાનવરોમાં ઉથલા મારવાના મુખ્ય કારણોમાં પ્રજનન અવયવોની ખામીઓ, જવાબદાર અંતસ્ત્રાવો, ચેપ/બગાડ, પ્રતિકુળ આબોહવા, સંતુલિત ખોરાકનો અભાવ, વારસાગત લક્ષણો, સારસંભાળ અંગેની ખામીઓ, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, એન્ટીબાયોટીક્સ તથા વંધ્યત્વ નીવારણયુક્ત દવાઓની આડઅસરો તથા પ્રજનન અવયવો પૈકી, ગર્ભાશય શ્રીવાના સુક્ષમ કોશોની વિકૃતિ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. સામાન્ય છતાં ખુબ જ અગત્યના નીચેના કારણો પણ ઉથલા મારવામાં જવાબદાર ગણાય:

(૧) માદા જાનવરોના ફાલુ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાંધ-પાડાની યોગ્ય પસંદગીના અભાવને લીધે ગાય-ભેંસોને ફાલુ કરાવવા છતાં ઉથલા મારી પછી વેતરમાં આવે છે. આથી સારી ગુણવત્તા વાળા તથા ઊંચી ફળદ્વારા ધરાવતા

સાંધ-પાડા પસંદ કરી કુદરતી રીતે કે કૃત્રિમ બીજદાન પદ્ધતિ માટે વાપરવા જોઈએ.

- (૨) વારંવાર સંવર્ધનને લીધે માદા જાનવરોના પ્રજનન અંગોને ચેપ લાગે છે. જે માટે નિયમિત પ્રાયોગિક પરીક્ષણ, કૃત્રિમ બીજદાન કર્યા બાદ જરૂર જણાય તો એન્ટીબાયોટીક્સ દવાઓનો ઉપયોગ વગેરે બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. આમ કરવાથી બગાડ થતો અટકાવી શકાશે અને માદા જાનવરોમાં વંધ્યત્વ નિવારી શકાશે.
- (૩) અમુક ચોક્કસ મહિનામાં કે ઋતુ સમયગાળામાં ગાય-ભેંસોમાં પ્રજનન કામગીરી સરળતાથી થઈ શકે છે. દા.ત.,, ગાયો લગભગ ઉનાળાની શરૂઆતના મહિના (માર્ચ અને એપ્રિલ) તથા ભેંસો શિયાળાની ઋતુમાં (નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી) સહેલાઈથી ગર્ભ ધારણ કરી શકે છે. આ સિવાય પ્રતિકુળ ઋતુના સમયગાળામાં ઉથલા મારવાની શક્યતા વધુ રહે છે. આ ઉપરાંત ઘણીવાર પણ ભાગ ભજવાય છે. ગરમીના દિવસોમાં ગાય-ભેંસને છાંયે રાખી કૃત્રિમ બીજદાન કર્યા બાદના તબક્કામાં કાળજી લેવામાં આવે તે જરૂરી છે.

હાલના વૈજ્ઞાનિક સંશોધન દ્વારા એ સિદ્ધ થયું છે કે શિયાળામાં થીજવેલ વીર્ય કે જે ઉનાળા જેવી ગરમ ઋતુમાં ગરમીમાં આવતી ભેંસો માટે કૃત્રિમ બીજદાનમાં ઉપયોગમાં કરવામાં આવે તો વધુ સફળતા મળે અને ઉથલો મારવાની સંભાવના

ઘટાડી શકાય. આમ ઋતુ, સમયગાળો તથા આબોહવાના લીધે જનવરોની ગરમીનો સમય, ઋતુચક તથા શરૂઆતનો ગર્ભ અને બચ્ચાનો વિકાસ વગેરે પરિબળો પર મહદેંશે ફાળો છે.

(૪) ઉથલા મારતા જનવરોમાં વળી ગયેલું, બહાર વધુ ઉપસેલું, અંદર વધુ ઉપસેલું કે ઉલટસુલટ ઉપસેલ ગર્ભશય મુખ કે જેને લીધે કૃત્રિમ બીજદાન કે કુદરતી સંવર્ધન દરમિયાન વીર્ય ગર્ભશયમાં પસાર થઈ શકતું નથી, તે માદા જનવરો ઉથલા મારે છે. આ પ્રકારની ક્ષતિ માટે યોગ્ય નિદાન, પ્રાયોગિક ચકાસણી તથા એ અંગે જરૂરી સારવાર અગત્યની છે. આમ થવાના કારણમાં વારંવાર કાળજી વિના થયેલ કૃત્રિમ વીર્યદાન કે વિયાણ સમયની ઈજાઓ છે.

### ઉથલા મારવા માટે યોગ્ય નિદાન પદ્ધતિઓ:

ગુજરાત રાજ્યમાં સારી ઓલાદની ભેંસો તથા ગાયો છે, તેથી દુધાળા જનવરોનું સારું ઉત્પાદન જાળવવા માદા જનવરોની સંવર્ધન કામગીરી સઘન રીતે સફળ નીવડે તો જ ૧૨ થી ૧૩ મહીને વિયાણ થઈ શકે ને તેથી ઉથલા મારતા માદા જનવરની વ્યક્તિગત દેખરેખ સાથે નિષ્ણાંત ડોક્ટર દ્વારા નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જે માટે નોંધે મુજબના પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ.

- સંપૂર્ણ પ્રજનન અવયવનું પરીક્ષણ.
- ચેપ/બગાડ સામે પ્રાયોગિક ચકાસણી અને દવાઓનો ઉપયોગ.
- અંડબીજ છું પાડવા અંગે વિગતવાર તબીબી અભ્યાસ.
- અંડવાહિની નલિકાની વૈજ્ઞાનિક ચકાસણી.
- પ્રજનન અંગોની વિકૃતિનો અભ્યાસ.

### ઉથલા મારતા અટકાવવા માટે જરૂરી સારવાર અને કાળજી:

તબીબી દ્રષ્ટિએ આ બધા પાસાઓનો અભ્યાસ ધ્યાન પૂર્વક લઈ, ઉથલા મારવા સામે યોગ્ય સારવાર નીચે મુજબ લઈ શકાય.

- ઉથલા મારવા જેવા સામુહિક પ્રશ્ન માટે ગરમીમાં આવેલ માદા જનવરોની નોંધણી તથા જરૂરી સમયે થયેલ કૃત્રિમ બીજદાન અગત્યનું છે.
  - માદા જનવરો માટે વપરાયેલ સાંધ-પાડાની વીર્ય ગુણવત્તા ઉત્તમ પ્રકારની તથા વધુ ગતિશીલ શુકાણુવાળું વીર્ય હોવા જરૂરી છે.
  - મૈથુન દરમિયાન બગાડના પ્રવેશનો જરૂરી સામનો અને તે અંગેની કાળજી જેમાં સારી ગુણવત્તાવાળા સાંધ-પાડાની પસંદગી માદા જનવરોના સંવર્ધન માટે કરવી જોઈએ.
  - સંવર્ધન રહેઠાણ તથા વિયાણ જગ્યાની ચોખ્ખાઈ, સાફ્ન-સફાઈ એ અગત્યની બાબત છે.
  - જનવરની ચોક્કસ પ્રકારની સારસંભાળ કે જેમાં નિયમિત સમતોલ આહાર, પાણી, કાળજીનો સમાવેશ થાય છે. માદા જનવરોની સંવર્ધન ક્ષમતા તથા વખતોવખત તે અંગેનું પરીક્ષણ ને નોંધણી જરૂરી છે.
- ખોરાકની બાબતે સંતુલિત ખોરાકમાં વિટામિન્સ, ખનીજક્ષારો જરૂરી છે. જેના લીધે શારીરિક ક્રિયાઓ નિયમિત ચાલે છે, તેમજ પ્રજનન અવયવો નિયત સમયગાળામાં વિકસિત બને છે. આથી ખોરાકમાં દાણ તથા ઘાસચારો વગેરે જરૂરી ગણાય છે.

## સંવર્ધન માટે સારા પશુઓની પસંદગી:

વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સારા વારસાગત લક્ષણોવાળા જાનવરોની પસંદગી તથા સંવર્ધન લાયક, ઉત્તમ આનુવંશિક લક્ષણોયુક્ત સાંધ/પાડાનો સમાવેશ એ ખુબ નાજૂક તેમજ અગત્યનું પાંસુ છે. ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતા સાંધનો ઉપયોગ ગાયોના સંવર્ધન માટે કરવાથી ઉત્તરોત્તર વધુ ઉત્પાદન મેળવી શકાય અથવા ઓછી ક્ષમતા ધરાવતી ગાયોમાં સંકર સંવર્ધનથી વધુ ઉત્પાદન મેળવી શકાય. ભેંસોમાં જે તે ઓલાદમાં ઉત્તરોત્તર સુધારો કરવા સંવર્ધન કામગીરી સારા સાંધ-પાડા દ્વારા થવી જોઈએ. આમ, માદા જાનવરોની સાથે સાથે નર જાનવરોની પસંદગી ઉચ્ચ ગુણવત્તાના ધોરણે થવી જોઈએ.

## જાતીય પરીક્ષણા:

જાનવરોમાં ચેપ/બગાડ શરૂઆતના તબક્કાથી અટકાવી શકાય. કુદરતી સંવર્ધન કે કૃત્રિમ વીર્યદાન ઉપરિસ્થિત જાતીય રોગો અટકાવી સકાય ને તેને લીધે વારંવાર ઉથલા મારવાનું નકારી શકાય.

જાતીય પરીક્ષણમાં વિગતવાર નર- માદા જાનવરોના પ્રજનન અવયવો ચકાસવા, પ્રાયોગિક પરીક્ષણ હાથ ધરવું તથા ક્ષતિ જણાય તો ત્યાં યોગ્ય ઉપાય સૂચવવા. આ માટે નિષ્ણાતોની સેવાઓ લેવી. જાતીય પરીક્ષણ માટે બેડૂત પશુપાલકોને જરૂરી જ્યાલો સ્પષ્ટ કરાવવા જોઈએ. આનાથી નર/માદા જાનવરોને બીજી આડઅસર ના થતા તેના જરૂરી સુધારા અંગે ખબર પડે તેમણે.

## સારવાર અને ઉપાયો:

અધતન વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ તબીબી સારવાર કે જેમાં ઉથલા મારતા જાનવરોની સારવાર અને ઉપાયો નીચે મુજબ કરવા જોઈએ. આ માટે નિષ્ણાત પશુચિકિત્સક ની સેવાઓ મેળવી શકાય.

- કૃત્રિમ બીજદાન કે કુદરતી રીતે ફિલિત કરાવવાનો સમય તથા અંડપીડમાંથી અંડબીજ છુટું પાડવાનો સમય સુસંગત હોવો જરૂરી છે., નહીંતર કરેલ સંવર્ધન/પ્રજનન કામગીરી નિષ્ફળ જાય છે ને ગાય-ભેંસ પુનઃ ઉથલા મારે છે.
- અંડવાહિની નલીકાની રૂક્ષવટ માટે ખાસ તપાસણી તથા પ્રાયોગિક પરીક્ષણ શક્ય હોય તો કરવું જોઈએ.
- ગર્ભાશયના અંદરના પડના સોજાનું નિદાન કરી યોગ્ય સારવાર કરવી જોઈએ. આ માટે ગર્ભાશયનો અંદરનો છેદ લઈ પ્રાયોગિક પરીક્ષણ ચકાસવું અને તે મુજબ એન્ટીબાયોટીક્સ / અંતઃખાવિક દવાઓ અપાવવી.
- અંડબીજ અંડપીડમાંથી મોટું છુટું પડે તો તે અંગેની વૈજ્ઞાનિક ચકાસણી કરવી જોઈએ. હુમન કોરીઓનીક ગોનાડોટ્રોપીન જેવી દવાઓનો ઉપયોગ અંડબીજ સમયસર છુટું પાડવા માટે કરી શકાય.
- અંડપીડમાંથી ડીમ્બ છુટું ન પડે તો માદા જાનવર ગરમીમાં આવ્યેથી છ થી દસ દિવસે જાતીય પરીક્ષણ કરવું. જેમાં પીળા મશાની ખાતરી કરી શકાય. ગીંબ છુટું ન પડતું હોય તેવા ડિસ્સાઓમાં હુમન કોરીઓનીક ગોનાડોટ્રોપીન દવા વાપરવી સલાહ ભરેલી છે.
- માદા જાનવરોના ઋતુચકના બીજા તબક્કાઓના અભાવ (લુંટીયલ ડેફિશીયન્સી) નું નિદાન જરૂરી છે. લ્યુતીયોટ્રોફિક દવાઓ તરીકે હુમન કોરીઓનીક ગોનાડોટ્રોપીન આપ્યા બાદ પુનઃ ગરમીમાં આવતા જાનવરોમાં કૃત્રિમ બીજદાન કરવું જોઈએ.

# પશુઓના આરોગ્યની જળવણી

ડૉ. ડી. બી. સાધુ<sup>૧</sup>, ડૉ. મહુલ પટેલ<sup>૨</sup>, ડૉ. એ. આદ. શાહ<sup>૩</sup>,  
૧. મદ્દનીશ પ્રાધ્યાપક, ૩. શિક્ષણ સહાયક,  
વેટરનરી કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ

આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હોવાથી પશુપાલન એ આપણા દેશના ખેડૂતોનું આવક વધારવાનું ઉત્તમ સાધન બની રહે છે અને તેથી જ પશુઓની આરોગ્ય જળવણી એ અધિક મહત્વ ધરાવે છે. પશુપાલન ત્યારે જ ફાયદાકારક બને છે જ્યારે પશુઓનું આરોગ્ય સચવાઈ રહે. પશુઓનું સ્વાસ્થ્ય જળવી રાખવા માટે મુખ્યત્વે ગ્રાશ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

## ૧. પોષણઃ



પશુપાલનથી વધારેમાં વધારે લાભ લેવા માટે પશુઓને તેમના ઉત્પાદન પ્રમાણે સંતુલિત આહાર આપવો જોઈએ. સંતુલિત આહાર એટલે એવો આહાર કે જેમાં પશુઓના શરીર માટે જરૂરી એવા બધાં પોષકતત્વો યોગ્ય માત્રામાં ભળી રહે. પશુઓને આપવામાં આવતો આહાર સ્વચ્છ, દુર્ગંધ વગરનો અને ફૂગ વગરનો હોવો જોઈએ. પશુઓને આહાર નિશ્ચિત સમયે નિયમિત ખવડાવવો જોઈએ.

ખોરાકમાં જો કોઈ બદલાવ કરો તો તે ધીમે ધીમે કરવો જોઈએ કેમ કે ઘણીવાર ખોરાકમાં અચાનક કરવામાં આવેલ બદલાવને કારણે પશુઓ ખાવાનું ધોડી હેતાં હોય છે. ખોરાકમાં બદલાવ ઝતુ, મુલ્ય અને ઉપલબ્ધતા અનુસાર થતો હોય છે. પશુઓના શરીરમાં ક્ષારની ઉણપ ના સર્જાય તે માટે મીહું અને મિનરલ મિક્સર ખવડાવવું જોઈએ. પશુઓમાં જો ક્ષારની ઉણપ સર્જાય તો પશુ કમજોર થઈ જતું હોય છે. અને તેની રોગ-પ્રતિકારક શક્તિ નબળી પડે છે તથા સાથે સાથે તેમનું દૂધ-ઉત્પાદન પણ ઘટી જાય છે. મિનરલ મીક્સર આપવાથી પશુઓની પ્રજનનની સમસ્યાઓ પણ દૂર થઈ જતી હોય છે.

શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા બેંસ/સંકર ગાયને બે કિલો સમતોલ દાશ આપવું જોઈએ. પાંચ માસની ગાભણ અવસ્થા પછી દેનિક એક થી દોઢ કિલો વધારાનું દાશ આપવું જોઈએ. પશુને ખોરાકમાં નિયમિત ૩૦ ગ્રામ જેટલું મિનરલ મિક્સર અને ૨૫ ગ્રામ મીહું આપવું જોઈએ. દૂધાળા પશુને સામાન્ય રીતે દરરોજ ૨૦ કિલો લીલોચારો તથા ૮-૧૦ કિલો સૂકો ચારો આપવો જોઈએ.

પશુઓને દરરોજ પૂરતા પ્રમાણમાં સ્વચ્છ અને જંતુરહિત પાણી ઉપલબ્ધ હોવું જોઈએ. શિયાળામાં એકદમ ઠંડા પાણીને બદલે હુંફાળું પાણી પીવડાવો અને ઉનાળામાં ઠંડુ પાણી પીવડાવો. તળાવનું પાણી પીવડાવવાનું ટાળવું જોઈએ કેમકે આનાથી ઘણા બધા ફૂમિ-જન્ય રોગ થતા હોય છે.

## ૨. રહેઠાણ વ્યવસ્થા:



પશુના સ્વાસ્થ્ય પર તેનાં આજુબાજુના વાતાવરણની સીધી જ અસર થાય છે. આથી વાતાવરણીય તાણ (વધુ પડતી ગરમી, હંડી, વરસાદ) ના પડે તેનાં માટે યોગ્ય રહેઠાણ વ્યવસ્થા કરવી જોઈએ. રહેઠાણ હંમેશા જમીન પરના પાણીનો નિકાલ થઈ જાય તેવી ઊંચાઈવાળી જગ્યાએ રાખો. રહેઠાણની લંબાઈ પૂર્વ-પશ્ચિમ દિશામાં રાખવી. રહેઠાણનું ભોયતળિયું સરખું અને તિરાડ વગરનું હોવું જોઈએ. ખૂબ જ ગરમીવાળા વિસ્તારમાં રહેઠાણની આજુબાજુ વૃક્ષો હોવા જોઈએ જેથી બપોરના સમયે પશુઓ વૃક્ષની છાયામાં બેસી શકે. રહેઠાણ હંમેશા સ્વશ્રી, હવા ઉત્તાસવાળાનું અને યોગ્ય પ્રકાશ મળી રહે તેવું હોવું જોઈએ. રહેઠાણમાં યોગ્ય સાફ-સફાઈ રાખવી તથા ચેપી રોગોથી પીડાતા પશુને જુદી જગ્યાએ બાંધવા. રહેઠાણની જગ્યાએ બિમારી ઉત્પત્ત કરવાવાળા સુક્ષ્મ જીવાણું ઓનો ઉપદ્રવ ના થાય એ માટે ફીનાઈલ કે મેલાથીયનના પ્રવાહીથી દરરોજ સાફ કરાવવું જોઈએ. તેમજ પશુઓના વાડાની આજુબાજુ કે તેમનાં ચરવાની જગ્યાની આજુબાજુએ પાણીનો ભરાવો ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પશુઓના મળમૂત્ર તથા નવડાવવા અને ભોયતળિયું ધોવામાં વપરાયેલા પાણીનો રહેઠાણમાંથી યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી.

## ૩. રોગપ્રતિબંધકપગલાં:



પશુઓમાં ઘણા બધા એવાં રોગો છે કે જે બહુ જ પ્રાણધાતક છે પરંતુ તેમને રસીકરણ દ્વારા અટકાવી શકાય છે. આથી સમયાંતરે રસીકરણ કરાવવું જોઈએ. તેમાં મુખ્યત્વે કાળિયો તાવ, ગાંઠિયો તાવ, બળિયો, ખરવા-મોવાસા, ગળશુંઢો, થાયલેરીઓસીસ, ચેપી ગર્ભપાત, હડકવા, ધનુર્વા વગેરે છે. રસીકરણ યોગ્ય સમયે અને યોગ્ય સમયાંતરે કરાવવું લાભદાયી છે. પશુઓમાં ટી.બી. (ક્ષય રોગ), જે.ડી. (જોહન્સ ડીસીજ) અને ચેપી ગર્ભપાત (ભુસેલ્વોસીસ) જેવા રોગોનું દર વર્ષે પરિક્ષણ કરાવવું જોઈએ. જો કોઈ પશુમાં આવા રોગ જણાય તો તેમને અન્ય સ્વસ્થ પશુઓથી અલગ તારવી, તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ. ટોળામાંથી ચેપી રોગગ્રસ્ટ પશુને અન્ય સ્વસ્થ પશુઓથી અલગ તારવી તથા તેમને અલગ રહેઠાણ, ખોરાક અને પાણી આપવું જોઈએ. નવજાત બચ્ચાઓને ૧૫ દિવસની ઉંમરમાં પ્રથમ ડોઝ, ૩૦ દિવસે બીજો ડોઝ, ૪૫ દિવસે ત્રીજો ડોઝ તેમજ ત્યારબાદ દર ૧૫ દિવસે તુ મહિનાની ઉંમર સુધી અને પછી ૧ મહિને ૬ મહિનાની ઉંમર સુધી પશુ ચિકિત્સકની સલાહ મુજબ કૂમિનાશક દવા આપવી. પુખ જાનવરોમાં ચોમાસા પહેલાં અને ચોમાસા પછી તેમ વર્ષમાં બે વાર કૂમિનાશક દવા આપવી.

# કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ અને તેના ફાયદા

ડૉ. તન્બીરફાતિમા મોમિન, ડૉ. વિશાલ સુથાર અને ડૉ. ડી.બી.પાટીલ

કામધેનુ ચુનિવર્સિટી, ગાંધીનગર

કુમ્હા ગામ (સારન, બિહાર)ના સાર્થક તિવારી એ ઈફકો કિસાન સંચારમાં કોલ કર્યો. સાર્થકની ગાયના પગમાં થોડો ધા હતો. આ સમસ્યાની ચર્ચા તેણે ઈફકો કિસાન સંચારના પશુધન સલાહકાર સાથે કરી. ઈફકોના ડોક્ટરે દવાઓ લખી આપી. આ સારવાર તેને માત્ર રૂ. ૧૩૦/- માં પડી.

તેવી જ રીતે, દેશના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો પણ ક્યારે રોપણી કરવી, કેટલું ભાતર આપવુ, પાકને રોગોથી બચાવવાના ઉપાયો ઘરે બેઠા મેળવી શકે છે. આ છે આધુનિક ખેતી અને પશુપાલન!!! જ્યાં ખેડૂતો અને પશુપાલકો પોતાની સમસ્યાઓ આંગળીના ટેરવે અથવા એક કોલથી દૂર કરી શકે છે.

ખેડૂતો દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ વધી રહ્યો છે. દેશના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્વેસ્ટર્મેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ કેન્ટ રેટિંગ એજન્સી (ICRA) મુજબ, ૩૦ ઓક્ટોબર, ૨૦૧૬ સુધી ભારતમાં ૧૦૭૮ મિલિયન મોબાઈલ સબસ્ક્રિપ્શન હતા અને તેમાં વાર્ષિક ૭.૫% નો વધારો થાય છે (ICRA Research Services, 2017). ભારતમાં ઇટરનેટ વપરાશકર્તાની સંખ્યા ૪૦% ના દરે વધી રહી છે જે વૈશ્વિક ૮% ની સરખામણીએ ઘણી વધારે છે (ETtech, 2016).

ભારતમાં લગભગ ૫૮% જેટલી વસ્તી એક યા ભીજ રીતે ખેતી અથવા તેને સંલગ્ન પશુપાલન પર આધાર રાખે છે. આ પરિસ્થિતિમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે સમય સાથે આમૂલ પરિવર્તન લાવવુ

જરૂરી છે. પરંતુ સહકારી અને ખાનગી એજન્સી દ્વારા માત્ર ૪૧% ખેડૂતોને જ વિસ્તરણ શિક્ષણનો લાભ મળ્યો છે જ્યારે સરકારી વિસ્તરણ એજન્સી માત્ર ૧૧% લોકો સુધી જ પહોંચી શકી છે. ભારતમાં દર ૨૮૭૮ ખેડૂત દીઠ એક વિસ્તરણ કાર્યકર ઉપલબ્ધ છે!

બદલાતા સમયની સાથે સ્ટાર્ટ અપ્સ અને ટેક કંપનીઓ ખેડૂત ઉપયોગી એપ્સ બનાવી રહી છે. આ એપ્સ ખેડૂતોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પુરું પાડે છે જેમાં પાકના જતનથી માંડીને પ્રાણીઓના ઉછેરનો સમાવેશ થાય છે. ભારતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે માહિતી તકનીકનો વધી રહેલો ઉપયોગ સારી બાબત છે પરંતુ આ એપ્સની કેટલીક મર્યાદા છે. આ એપ્સ ખેડૂતોને એસ.એમ.એસ., કોલ દ્વારા માહિતી પુરી પાડે છે. જો આ માહિતી એસ.એમ.એસ. દ્વારા આપવામાં આવે તો મુખ્યત્વે સર્વ સામાન્ય હોય છે જે દરેક કેસમાં લાગુ ન પણ પડે. જો આ માહિતી કોલ પર આપવામાં આવે તો તે મુખ્યત્વે બજે છેઠેથી થતી માહિતીની આપ-લે પર આધાર રાખે છે અને નિષ્ણાતો દ્વારા ૨૪ થતી માહિતીની ગુણવત્તા પર અસર કરી શકે. આ ઉપરાંત, હાલમાં જે એપ્સ ઉપલબ્ધ છે તે મુખ્યત્વે ખેતીને કેંદ્રિત કરી બનાવેલ છે. આવા સંજોગોમાં પશુપાલન અને પશુ સંવર્ધન માટે વોટ્સ એપનો ઉપયોગ કરી શકાય છે.

વોટ્સ એપનો ઉપયોગ ૧૮૦ દેશોમાં ૧ બિલિયન જેટલા લોકો કરી રહ્યા છે. શરૂઆતમાં તેનો ઉપયોગ વ્યક્તિગત સંદેશા માટે થતો હતો પરંતુ તેના શ્રુપ ચેટિંગ ફિચરને લીધે કૃષિ અને પશુપાલન

વ्यवसायिकोમાં તે ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે માહિતીના પ્રચાર પ્રસારમાં વોટ્સ એપની ઉપયોગિતા જાળવા હિમાચલ પ્રદેશમાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. હિમાચલ પ્રદેશમાં કૃષિ વિજ્ઞાન કેંદ્ર (કેવીકે) હોય તેવા ૧૨ માંથી ૮ જિલ્લા પસંદ કરાયા. કેવીકેના સહયોગથી સોશિઅલ મિડિયાનો ઉપયોગ કરતા હોય તેવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી. ત્યારબાદ, દરેક જિલ્લામાંથી ૧૨ ખેડૂતો પસંદ કરવામાં આવ્યા એટલે કે ૮૮ ખેડૂતોનું એક વોટ્સએપ ચ્રૂપ “ઉત્તે કૃષિ આવામ પશુપાલન” બનવવામાં આવ્યું. આ ચ્રૂપમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ ઉમેરવામાં આવ્યા જેમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટી અને રાજ્યના પશુપાલન વિભાગના પશુચિકિત્સકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ગ્રાસ મહિનાના અભ્યાસને અંતે કુલ ૫૦ પ્રશ્નો ખેડૂતો તરફથી આવ્યા. આમાંથી મોટા ભાગના પ્રશ્નો ફોટોગ્રાફિસ સાથે પૂછવામાં આવ્યા. પરિણામરૂપે પશુચિકિત્સકો દ્વારા અપાતી સલાહની ગુણવત્તામાં પણ સુધારો થયો. આ ઉપરાંત, આવેલ ૫૦ પ્રશ્નોમાંથી ૧૦ પ્રશ્નોનો જવાબ ચ્રૂપના બાકી ખેડૂતો દ્વારા આપવામાં આવ્યા. આ ખેડૂતો એકબીજાથી અપરિચિત હતા એટલે કે વોટ્સ એપ દ્વારા ખેડૂતો એકબીજા સાથે પણ વિચાર વિમર્શ કરી શકે છે. આમ, વોટ્સ એપના ઉપયોગ વડે સંસ્થાઓ અને ખેડૂતો વચ્ચેની ખાડી પૂરી શકાય છે.

વોટ્સ એપ ઉપરાંત, ફેસબુકનો ઉપયોગ પણ ખેડૂતો સુધી માહિતી પહોંચાડવા થઈ શકે છે. Livestock Information and Market Centre પણ આવું જ એક ચ્રૂપ છે જેમાં પશુપાલકો, વૈજ્ઞાનિકો, સ્થાનિક આગેવાનો, વેપારીઓ તેના સભ્યો છે. આ ગૃહનીસંખ્યા ર વર્ષમાં બે ગણી થઈ ગઈ છે.

વોટ્સએપ અને ફેસબુક ચ્રૂપમાં રહેલ નિષ્ણાંતોએ એટિબાયોટિકના ઉપયોગ ન થાય તેની ખાસ કાળજ રાખવી જોઈએ કારણ કે એટિબાયોટિકનો અવિવેકપૂર્ણ ઉપયોગ અન્ય ઘણા પડકારો સર્જ શકે છે. નિષ્ણાંતોએ એટિબાયોટિક અને શિડ્ચુલ ડ્રગ્સ ચ્રૂપમાં પ્રિસ્કાર્ટબ કરવી જોઈએ નહિ.

રાષ્ટ્રીય દેરી વિકાસ સંસ્થાન (NDDB) દ્વારા “પશુપોષણ” એપ શરૂ કરવામાં આવી છે જેના દ્વારા ખેડૂતોને પશુપાલન સમબંધિત માહિતી જેવી કે ઉભર, દૂધમાં ફેટનું પ્રમાણ, આહાર, દૂધ ઉત્પાદન પુરી પાડવામાં આવે છે.

આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા આઈ-ખેડૂત (i-khedut) પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો તેમને મૂંજવતા પ્રશ્નો, સરકાર દ્વારા જાહેર થતી ખેડૂતો અંગેની માહિતી મેળવી શકે છે.

આમ, એપ્સ અને સોશિઅલ મિડિયાનો ઉપયોગ કરી ખેડૂતોને કૃષિ અને પશુપાલન અંગે ઝડપી માર્ગદર્શન પૂરું પાડી શકાય છે જે ભારતમાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે એક નવી જ કાંતિ લાવી શકે છે.



# નફકારક દૂધ ઉત્પાદન - પશુપાલકની ભૂમિકા

ડૉ. તન્દીરફાતિમા મોમીના<sup>૧</sup> અને ડૉ. વિશાલ સુથાર<sup>૨</sup>

૧. કિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ, ૨. મદદનીશ પ્રાધ્યાપક, કામદેનુ યુનિવર્સિટી, ગાંધીનગર

ભારત વિશ્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે પ્રથમ કર્માંક ધરાવે છે. ભારતમાં તેરી ઉદ્ઘોગ એ ઝડપથી વિકાસ પામતા ઉદ્ઘોગમાંનો એક છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન ભારતનું કુલ દૂધ ઉત્પાદન ૧૫૫.૫૫ મિલિયન ટન હતું જે વિશ્વના કુલ ઉત્પાદનના ૧૮.૫% જેટલું છે. એક અહેવાલ મુજબ, ભારત સરકાર વર્ષ ૨૦૨૦ સુધી દૂધ ઉત્પાદનક્ષમતા ૧૯૧ મિલિયન ટન કરવાનું લક્ષ્ય ધરાવે છે. ભારતનું દૂધ ઉત્પાદન એ ભારતમાં રહેલ પશુધન સંખ્યાને આભારી છે. ભારતમાં દેશી ગાયનું ઉત્પાદન ૨.૫૪ કિગ્રા/ દિવસ છે જ્યારે ભેંસનું પ્રતિ દિવસ દૂધ ઉત્પાદન ૫.૧૫ કિગ્રા છે જે પ્રાણી દીઠ ઘણું ઓછું છે. ભવિષ્યની વધતી જતી દૂધની માંગને પહોંચી વળવા પ્રાણી દીઠ દૂધ ઉત્પાદન વધારવું જરૂરી છે. નફકારક દૂધ ઉત્પાદન માટે પાડી/વાછરડીનું સમયસર પુખ્ખ થવું જરૂરી છે. જો પાડી/વાછરડી સમયસર પુખ્ખતાન પામે તો તે ગાભણ ન થાય અને ત્યાં સુધી દૂધ ઉત્પાદન શક્ય ન બને. ભારતમાં પાડી/વાછરડીમાં મોડી પુખ્ખતાનું મુખ્ય કારણ પોષણરહિત અને અપૂરતો ખોરાક છે. ઘણીવાર પાડી/વાછરડી વેતરે તો આવે છે પરંતુ ફ્લીકરણ થતું નથી કારણ કે, તેઓમાં લિંક, કોપર, ક્રીબલ્ટ જેવા કારોની ઉણાપ હોય છે. જેમ આજનું બાળક કાલના દેશનું ભવિષ્ય છે તેમ આજની પાડી/વાછરડી દૂધ ઉત્પાદનનું ભવિષ્ય છે. આથી પશુનું શરૂઆતથી જ ધ્યાન રાખવું જરૂરી છે જે અર્થે કેટલીક મહત્વની માહિતી અહીં દર્શાવી છે.

## ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

- પાડી/વાછરડીના જન્મ બાદ અડવા કલાકમાં જ ખીરું/ખરાટુ પીવડાવવું ખૂબ અગત્યનું છે. ખીરું/ખરાટુ વિવિધ રોગો સામે રક્ષણ આપે છે.
- પાડી/વાછરડીના જન્મના બીજા મહિનાથી જ કારનું મિશ્રણ આપવું જોઈએ.
- પાડી/વાછરડી જ્યારે પુખ્ખ વજનના ૫૦% વજન ધરાવે છે ત્યારે તે સામાન્ય રીતે પ્રજનનક્ષમ બને છે. આમ, પાડી/વાછરડીના ખોરાકનું ધ્યાન રાખવું ખૂબ અગત્યનું છે.
- પશુ ગરમીમાં આવે તો તેને ઓળખવું સૌથી અગત્યનું છે. ખેડૂતે પશુ ક્યારે ગરમીમાં આવે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પશુની સંવર્ધન માહિતી રાખવી જરૂરી છે. આ માટે દરેક પ્રાણીની માહિતીની જગાવણી કરવી જરૂરી છે.
- પશુ ક્યારે ગરમીમાં આવે છે, ક્યારે બીજદાન કરવામાં આવ્યુ, ક્યારે ગર્ભાવસ્થાની તપાસ કરવામાં આવી જેવી બાબતોની નોંધણી કરવી જરૂરી છે. આ નોંધણી પરથી ખેડૂત અનુમાન લગાવી શકે છે કે પશુ ક્યારે વેતરે આવશે.
- ક્યારેક ગાય/ભેંસ છાની વેતરે આવે છે. આવા સંજોગોમાં ખેડૂતે તપાસ કરાવવી જોઈએ અને પશુચિકિત્સકની સલાહ મુજબ પગલા લેવા જોઈએ.

- પશુ જ્યારે ગરમીમાં આવે ત્યારે તે કેવી લાણી કરે છે તે નોંધવું પણ જરૂરી છે. જો લાણી તેલની ધાર જેવી ચોખ્ખી હોય તો તે સામાન્ય છે. પરંતુ કેટલીકવાર લાણી સફેદ અથવા પીળા રંગની જોવા મળે છે જે રોગિષ ગર્ભશયની નિશાની છે. આની સમયસર સારવાર કરાવવીએ તો જ પશુ ગર્ભધારણ કરી શકે અને દૂધ ઉત્પાદન મેળવી શકાય.
- બીજદાન કરવ્યા બાદ જો પશુ વેતરે ના આવે તો તેની તપાસ કરાવવી જોઈએ. બીજદાન કરાવ્યાના ૫૦ દિવસે ગર્ભાવસ્થાની તપાસ કરાવવી જોઈએ. એક અભ્યાસ મુજબ, જો ગાય નિયત સમય કરતાં વધુ સમય ખાલી રહે તો પ્રતિ દિવસ રૂ.૨૮૧/-ની ખોટથાય છે.
- જો પશુ ગાભણ હોય તો તેની સંપૂર્ણકાળજ રાખવી ખૂબ અગત્યની છે. તેના ખોરાક પાણીથી લઈને તેના રહેઠાણની કાળજ રાખવી પડે. પશુને ૨૪ કલાક પાણી મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવું. ભૌંયતળિયું લપસી ના પડાય તેવું હોવું જોઈએ. પશુને હવા ઉજાસવાળી જગ્યાએ રાખવું પરંતુ સીધો સૂર્યપ્રકાશ ન પડે તેનું ધ્યાન રાખવું.
- બીજદાન સમયે ખેડૂત અથવા જે વ્યક્તિ સાથે પશુ પરિચિત હોય તેનું હોવું જરૂરી છે. આનાથી પશુ ગભરાશે નહિ અને તણાવમુક્ત રહેશે જેનાથી ફ્લીકરણની સંભાવના વધી જાય છે.
- બીજદાન પહેલા પશુનો પાછળનો ભાગ હુંફણા પાણીથી ધોવો જોઈએ અને ત્યાર બાદ ચોખ્ખા કપડાથી સાફ કરવો જોઈએ.
- બીજદાન સમયે ખેડૂતે ધ્યાન રાખવું કે બીજદાન કરનારે બીજદાન પહેલા પશુની ચકાસણી બરાબર કરી છે. કેટલીક વાર પશુ ગાભણ હોય છે અને જો ચકાસ્યા વિના જ બીજદાન કરી દેવામાં આવે તો પશુ પાછું ફરે છે. આથી, બીજદાન પહેલા પશુની બરાબર ચકાસણી થાય તે ધ્યાન રાખવું જરૂરી છે.
- બીજદાન થયા પછી પ્રાણી પર પાણી નાખવું હિતાવહ છે. આને લીધે પ્રાણીઓ તણાવમુક્ત બને છે.
- ગરમીના સમય દરમિયાન તબેલામાં પંખા, કૂલર અથવા આસપાસ તળાવની વ્યવસ્થા હોવી જોઈએ. એક અભ્યાસ મુજબ, ગરમીના તણાવને લીધે પહેલા વેતરમાં દૂધ ઉત્પાદનમાં ૧૦-૩૦% નો ઘટાડો જોવા મળે છે.
- બીજદાન કરાવતી વખતે ખેડૂતે મૂકાનારા ડોઝની માહિતી મેળવવી જોઈએ. આ માહિતી બીજદાન કરનાર પાસેથી મળશે. જો ખેડૂત પાસે ગીર ઓલાદ હોય અને તે ગીર જ ઓલાદ મેળવવા માંગતો હોય તો ડોઝ પણ ગીર પાડાનો હોય તે જરૂરી છે નહિતર આવનાર ઓલાદ સંકર જાતની હશે.



# પશુપાતનમાં પાણીનું મહત્વ

ડૉ. આર. એમ. પટેલ અને ડૉ. શ્રીજા પી. સ્વામી  
પશુપાતન પોલીટેકનિક, કામદેનુ ચુનિવર્સિટી, હિમતનગર - ૩૮૩ ૦૦૧

દરેક સજીવ માટે પાણી એ ખોરાક કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. પાણી વગર કોઈપણ જીવ જીવિત રહી શકે નહીં. પુખ પશુનાં શરીરનાં અમુક ભાગોમાં તો પાણીનું પ્રમાણ ૭૦ થી ૮૦ ટકા સુધીનું હોય છે. પ્રાણીને પાણી ની જરૂરિયાત સૌથી વધુ હોય છે. પાણી શરીરની અંદર એક આદર્શ પ્રવાહીનું કામ કરે છે અને જો પશુના શરીરના દસમા ભાગનું પાણી ઓછું થાય તો પશુનું મૃત્યુ થઈ શકે છે. પાણીની વિશિષ્ટ ગરમી વધુ હોવાથી તે શરીરની અંદર ચાલતી ચ્યાપચયની કિયાઓ દરમિયાન ઉત્પન્ન થતી ગરમીનું શોખણ કરે છે અને શરીરના તાપમાનને ઘણે અંશે જાળવી રાખે છે. પાણીની અંદર રહેલ ગુપ્ત ગરમી પણ શરીરના ઉઝ્જાતામાનને જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. પ્રાણી કાર્બોનિટ પદાર્થો વગર લાંબા સમય સુધી જીવી શકે છે પરંતુ તે પાણી વગર ખુબ જ ઓછા સમયમાં મૃત્યુ પામી શકે છે. તેના ઉપરથી જ્યાલ આવે છે કે પાણી પશુઓના ખોરાકનું એક અતિઆવશ્યક અને અત્યંત જરૂરી ઘટક છે.

પશુઓને તેનાં વજન/ઉત્પાદન પ્રમાણે પાણીની જરૂરિયાત જુદી જુદી હોય છે. પશુઓને પાણીની જરૂરિયાત ખોરાકમાં લીલોચારો આપવાથી તેમાં રહેલ પાણી પશુનાં શરીરમાં પહોંચે છે, પશુઓ પાણી પીવે છે તેથી તેમજ શરીરમાં ચાલતી ચ્યાપચયની કિયાઓ દ્વારા શરીરમાં પાણી ઉત્પન્ન થાય છે તેના દ્વારા પૂર્ણ થતી હોય છે. આ ઉપરાંત શરીરમાંથી પાણીનું ઉત્સર્જન એટલે કે નિકાલ પેશાબ વાટે, છાણ સાથે તથા શ્વાસોચ્છવાસ દરમિયાન અને ચામડી દ્વારા થતા પરસેવાના રૂપમાં થાય છે.

પશુનાં શરીરમાં જ્યારે પ્રોટીન, કાર્બોનિટ પદાર્થો તેમજ ચરબીનું પાચન થાય છે ત્યારે ચ્યાપચયની કિયાઓ દરમિયાન પાણી ઉત્પન્ન થાય છે તેને મેટાબોલિક વોટર કહે છે. જલુકોઝ નાં એક અણુના વિધટનથી પાણીના ઇ અણુઓ ઉત્પન્ન થાય છે. આમ જીવનમાં અમુક અવસ્થાએ આ મેટાબોલિક વોટર જ શરીરની મોટા ભાગની પાણીની જરૂરિયાત પુરી કરે છે. દેડકા જેવા પ્રાણીઓ જ્યારે શીત અવસ્થામાં જમીનમા ઉંડે પડી રહે છે ત્યારે તેમની પાણીની જરૂરીયાત આ મેટાબોલિક વોટર દ્વારા પૂર્ણ થતી હોય છે.

પાણીમાં રહેલા જીવાણુની સંખ્યાના આધારે પાણીની ગુણવત્તા નક્કી કરવી:-

૧૦૦ મિલી પાણીમાં રહેલ કોલિફોર્મ જીવાણુની સંખ્યા	પાણીનો પ્રકાર
૧ કરતા ઓછી	ખુબ સારું પાણી, પીવાલાયક
૧-૨	સારું પાણી, પીવાલાયક
૩-૧૦	શંકાસ્પદ પાણી
૧૦ કરતા વધારે	ગંદુ પાણી, પીવાલાયક નથી.

પશુઓ માટે પાણીની જરૂરિયાત નક્કી કરતાં પરિભળો:-

(૧) પશુની જાતિ:-

પશુની જાતિ પ્રમાણે પાણીની જરૂરિયાત બદલાય છે જેમ કે ગાય, બેંસ, ઘેટાં, બકરાં વગેરેની પાણીની જરૂરિયાત જુદી-જુદી હોય છે.

## (૨) પશુની ઓલાદ:-

જે તે જાતિમાં પશુની ઓલાદ પ્રમાણે તેની પાણીની જરૂરિયાત જુદી જુદી હોય છે. જેમ કે ગીર ગાય, કાંકરેજ ગાય જેવી દેશી ગાયો કરતાં જરૂરી, હોલ્સ્ટેન ગાયો વધારે પાણી પીવે છે.

## (૩) પશુની ઉભરણ :-

નાના પશુઓ કરતાં પુખ્ત પશુઓને પાણીની જરૂરિયાત વધારે રહેછે.

## (૪) ખોરાક:-

પશુને જે ખોરાક આપવામાં આવે તે પ્રમાણે તેની પાણીની જરૂરિયાત બદલાય છે. સુકાચારો વધુ આપવાથી પશુને પાણીની જરૂરિયાત વધુ રહે છે. વધારે પ્રોટીન, ફેટવાળો ખોરાક તેમજ વધુ મીઠું, યુરિયા ભેળવેલ ખોરાક ખાવાથી પાણીની જરૂરિયાત વધે છે. લીલાચારામાં ૭૦ થી ૮૦ % પાણી હોવાથી લીલોચારો ખાતી વખતે પાણીની જરૂરિયાત ઓછી રહેછે. ચાંટણ ઈટમાં મીઠું, યુરિયા હોવાથી તે મુકવાથી પશુને પાણીની જરૂરિયાત વધારે રહેછે.

## (૫) અસ્તુ:-

ઉનાળામાં વાતાવરણમાં ખૂબ ગરમી હોય તેથી પશુને પાણીની વધારે જરૂર પડે છે અને શિયાળામાં ઓછી રહેછે.

## (૬) ઉત્પાદકતા:-

દૂધ આપતા પ્રાણીઓ અને કાર્ય કરતાં પ્રાણીઓના પાણીની જરૂરિયાત વધારે હોય છે. સામાન્ય રીતે ૧લીટર દૂધ ઉત્પાદન કરવા માટે વધારાના ૨ લીટર પાણીની જરૂરિયાત રહેછે. પુરતું સ્વચ્છ પાણી આપવાથી દૂધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં ૧૦% જેટલો વધારો મેળવી શકાય છે.

આ ઉપરાંત એકસરખી પરિસ્થિતિમાં પણ એક પશુની જરૂરિયાત બીજા પશુ કરતાં અલગ પડતી હોય છે.

## પાણીના શરીરમાં કાર્યો:-

- પાણી શરીરમાં જુદા જુદા પોષક તત્વોનાં પાચન, શોષણ અને વહન માટે મદદરૂપ થાય છે.
- પશુની વૃધ્ઘિ, વિકાસ, દૂધ ઉત્પાદન, કાર્ય વગેરે માટે પાણીની જરૂરિયાત રહેછે.
- શરીરમાંથી નકામો કચરો બહાર કાઢવામાં પાણી મહત્વનો ભાગ ભજવે છે.
- લોહીના પરિભ્રમણમાં પાણી મદદરૂપ થાય છે.
- પાણી શરીરનાં બંધારણમાં તેમજ શરીરમાં ચાલતી વિવિધ દેહધાર્મિક ડિયાઓનાં સંચાલનમાં મહત્વનો ભાગ ભજવે છે.
- પાણી શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે.
- પાણી વિવિધ ભાગોમાં બફર તરીકે કામ કરે છે. દા.ત. સાંધારોમાંનું પ્રવાહી, વગેરે
- પાણી આંખોની દ્રષ્ટિ માટે મહત્વનું ઘટક છે. તેમજ કાનમાં પણ ધની માટે મહત્વનો ભાગ ભજવે છે.
- પાણી ખોરાકનાં પાચન અને વહન તથા શોષણમાં અગત્યનો ભાગ ભજવે છે.
- પાણી પશુની તરસ સંતોષે છે. ખોરાકને પોચો અને સ્વાદિષ્ટ બનાવે છે.

આમ પાણી પશુ માટે ખૂબ જ અગત્યનું ઘટક છે. તેથી પશુને પીવા માટે હંમેશા સ્વચ્છ પાણી પુરતા પ્રમાણમાં આપવું જોઈએ. કુવા, તળાવ, બોરનાં પાણીને લેબોરેટરી તપાસ કરીને જ પીવાનાં

ઉપયોગમાં લેવું જોઈએ. વધુ કારવાળું પાણી પશુઓનાં ઉપયોગમાં લેવું જોઈએ નહીં. પશુઓ પાસેથી સારુ ઉત્પાદન અને કાર્ય શક્તિ મેળવવાની હોય પશુઓને જરૂરી આહાર ઉપરાંત સ્વચ્છ પાણી પશુને પીવા માટે ૨૪ કલાક મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જો તે ના હોય તો તેને દિવસમાં ઓછામાં ઓછું બે થી ત્રણ વાર તેમજ રાત્રે એક થી બે વાર પાણી આપવું જોઈએ. પશુને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે અને તેમાંથી ભેંસો અને સંકર ગાયોને તો પાણી સમયાંતરે આપવું જ જોઈએ. આ ઉપરાંત ભેંસોને દિવસમાં એકવાર તો પાણીથી ધમારવી જ જોઈએ. જેથી તેનાં શરીરનું તાપમાન થોડું નીચું આવે. ઉનાળામાં શક્ય હોય તો ઠંકુ પાણી મળે તેવી વ્યવસ્થા થઈ શકે તો ઘણું સારુ. પાણીમાં વિવિધ ધાતુઓ ઓગળેલી હોય તો તેની સુરક્ષિત માત્રા અતે આપેલ છે.

પશુઓ દ્વારા પાણીમાં ઓગળેલ કારોની ૧૦૦૦-૩૦૦૦ મિ.ગ્રા./લિ. ની માત્રા સહન કરી શકે છે. આ માત્રા જો ૩૦૦૦-૫૦૦૦ મિ.ગ્રા./લિ. હોય તો તે પાણી મરધાં માટે પીવાનાં ઉપયોગમાં લેવું નહીં. ૫૦૦૦-૭૦૦૦ મિ.ગ્રા./લિ. ની માત્રા પશુઓને હાનીકારક છે. પરતું તે ટેવાય ગયા પછી તેનાં પર કોઈ માઠી અસર થતી નથી. પરતું ૭૦૦૦ મિ.ગ્રા./લિ. થી વધુ કારવાળું પાણી પશુઓને નુકશાનકારક છે. આથી આવું પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય નહિં.

**જુદા જુદા પશુઓ માટે પીવાના પાણીની જરૂરિયાત:-**

પશુ	પાણીની દૈનિક જરૂરિયાત (આશરે લિટરમાં)
ધાવતાં વાઢરડાં	૧૦
વોડકીઓ નાની/મોટી	૨૦
વસુકેલ ગાય/ભેંસ	૬૦
દૂધાળા ગાય/ભેંસ	૬૦-૮૦
ઘેટાં	૪-૬
ઘોડો	૪૦
ઘોડી	૫૦
ઉંટ	૧૬-૩૨

**પાણીની તંગીથી પશુમાં થતી અસરો:-**

પશુઓમાં જો પાણીની તંગી આવે, પાણી ઓછું મળે તો તેની ખોરાક ખાવાની ક્ષમતા ઘટે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં વધુ જોવા મળે છે. તેથી પશુઓને ઉનાળાની ઋતુમાં ઠંડા પહોરનાં સમયે વહેલી સવારે અને સાંજે ખોરાક આપવાથી તે બરાબર ખાઈ શકે છે. આમ શરીરમાં પાણીની તંગી સર્જતાં, નાળીનાં ધબકારા વધે છે. તેમજ ગુદાનું તાપમાન પણ ઉચ્ચ જોવા મળે છે. લોહીમાં પાણીનું પ્રમાણ ઘટવાથી તે ઘણું બને છે તેમજ લોહીની માત્રાઘટે છે અને લોહીનું પરિભ્રમણ મુશ્કેલીથી થાય છે. પગ અને આંગણાઓમાં ધુજારી આવે છે અને ફીકા દેખાય છે.

ઉટ એક એવું પ્રાણી છે કે જે ઉચ્ચા તાપમાને પણ એક અઠવાદિયા સુધી પાણી વગર રહી શકે છે. તેનાં શરીરમાંથી ૨૦% જેટલું પાણી ઘટવા છતાં તેની તેનાં ઉપર કોઈ આડઅસર થતી નથી. મનુષ્યમાં દી ૧૦% પાણી ઘટે તો તેની શરીર પર આડ અસરો શરૂ થઈ જાય છે. આ ઉપરાંત પક્ષીઓમાં તેની ચરકમાં ખુબ જ ઓછું પાણી બહાર નીકળે છે આથી પાણીની શરીરમાંથી નાશ થતો નથી. અને પક્ષીઓને પાણીની જરૂરિયાત વધારે રહેતી નથી.

# પ્રાણીઓમાં ઓળખની પદ્ધતિઓ અને તેનું મહત્વ

ડૉ. એન. બી. ભાઈ, , ડૉ. એફ. એમ. કાપડિયા અને ડૉ. પી. પી. મકવાણા  
પશુપાલન પોલિટેકનિક, કામદેનું યુનિવર્સિટી, હિંમતનગર

જ્યારે ફાર્મિચાર વધારે જાનવર હોય ત્યારે દરેક જાનવર ને ઓળખવું મુશ્કેલ હોવાથી જુદી જુદી પદ્ધતિઓ વડે નંબર આપીને અથવા જુદી જુદી ઓળખાણ પદ્ધતિઓ અપનાવીને જાનવરને ઓળખી શકાય.

## ઓળખાણ પદ્ધતિઓનું મહત્વ:

- જાનવરોને અલગ કરવા માટે
- જાનવરનો વિમો લેવા માટે
- બિમાર જાનવરની સારવાર માટે
- જાનવરના ઉત્પાદનના આંકડા માટે
- કૂત્રિમ બીજદાન માટે
- રેકોર્ડ રાખવા માટે અથવા નિભાવણી માટે
- જન્મ અને મૃત્યુ વખતે
- ખરીદી અને વેચાણ વખતે
- અલગ અલગ પ્રકારના પશુઓની માવજત માટે

## ઓળખાણની જુદી જુદી રીતો:

૧. નામ આપીને: જ્યારે જાનવરોની સંખ્યા મર્યાદિત હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી છે. જેમા જાનવરનું નામ શરીરના કોઈ વિશિષ્ટ લક્ષણ પરથી દેવી કે દેવતાના નામ પરથી કે કોઈ સ્થળના નામ પરથી આપવામાં આવે છે. દા.ત. ગંગા, લાલી, પાર્વતિ વગેરે.

૨. ઈયર ટેંગિંગ (કાનમાં કડીવાળીને): આ રીતનો ઉપયોગ ધેટા અને બકરા, નાના અને મોટા

જાનવરોમાં થાય છે. જેમા એલ્યુમીનિયમ કે પ્લાસ્ટિકની પણી ઉપર પહે લો થાય નંબર આપવામાં આવે છે.

આ પણી ટેંગિંગ

ચીપિયાની મદદથી કાન ઉપર લગાડવામાં આવે છે. આ રીતમાં ધણીવાર કડી નીકળી જાય છે. તેથી વારંવાર લગાડવાની જરૂર પડે છે. આ પદ્ધતિનો ઉપયોગ સૌથી વધુ થાય છે.

૩. છુંદણા: આ રીતનો ઉપયોગ જાનવરના જન્મ પછી તરત જ ઓળખાણ આપવા માટે થાય છે. જેમા



ટેટ્રુંડિંગ ચીપિયાની મદદથી કાનની અંદરની સપાટી ઉપર ચિંદની છાપ પાડવામાં આવે છે. છાપ પડી ગયા પછી તરત જ છુંદણાની શાહીને રૂપે છાપ ઉપર ધસવામા આવે છે. શાહી સુકાઈ ગયા પછી છુંદણા ઉપરથી જાનવરની ઓળખ કરી શકાય છે. પરંતુ જાનવર મોટુ થાય ત્યારે નંબરના ડામ આપી ઓળખાણ કરવામાં આવે છે.

૪. ગરમ ડામ આપીને (હોટ બ્રાંડિંગ): આ રીતમાં લોખંડના બ્રાંડ નંબર ગરમ કરીને જાનવરના ખભા કે થાપા ઉપર ડામ આપવામાં આવે છે. ડામ આપતા



પહેલા ડામ આપવાની જગ્યાને પાણીથી બરાબર સાફ્ટ કરી એન્ટીસેપ્ટિક લગાડી જંતુ રહીત કરવામાં આવે છે. ડામ આપ્યા બાદ ૧૦ થી ૧૫ દિવસ સુધી ડ્રેસિંગ કરવામાં આવે છે. ડામ અઢિથી ત્રણ વર્ષની ઉમરે ખાસ કરીને શિયાળાની ઋતુમાં આપવામાં આવે છે. આ રીતે આપેલ નંબર જાનવરના મૃત્યુ સુધી સાથે રહે છે. આ કાયમી રીત છે.

૫. ફીજ ભાંડીગા: જેમાં નંબરને પ્રવાહી નાઈટ્રોજનમાં (-૧૮૮°સે.) બોળી ડામ આપવામાં આવે છે. ડામ આપેલા ભાગના વાળ સફેદ થઈ જતા નંબર વાંચી સકાય છે. આ પદ્ધતિનો ઉપયોગ ફક્ત કાળી ચામડી વાળા પશુઓમાં થાય છે.

૬. ઠંડા ડામ: જેમાં નંબરને જલદ કે દાહક



પ્રવાહીમાં બોળી ડામ આપવામાં આવે છે. પ્રવાહીની દાહક અસરને લીધે શરીરનો તેટલો ભાગ અલગ પડે છે તથા તે સહેલાઈથી નંબર વાંચી શકાય છે. આ પણ કાયમી રીત નથી.

૭. નંબર પ્લેટની મદદથી: આ રીતમાં પ્લેટ ઉપર જાનવરનો નંબર જે તે ફાર્મનું નામ, સ્થળ વગેરે



લખીને જાનવરના ગળામાં પહેરાવવામાં આવે છે. આ રીતમાં પ્લેટ ખોવાઈ જવાનો કે પડી જવાનો ભય હોવાથી કાયમી નંબર આપી શકતો નથી.

૮. કલર માર્કિંગ: આ રીતનો ઉપયોગ જાનવરના સમુહને ઓળખાણ આપવા માટે થાય છે. જેમાં એક



જાનવરની ઓળખ થઈ શકતી નથી પરંતુ તે ક્યા સમુહનું છે તે જાણી શકાય છે. આ માટે જાનવરના શરીર ઉપર રંગ તથા રસાયણ વડે ટપકા કે ધંબા કરવામાં આવે છે. ખાસ કરીને આ રીત ધેટા અને બકરામાં ખૂબ જ ઉપયોગી છે.

૯. ઈયર નોચિંગ: જાનવરના કાન ઉપર U કે ફ



આકારની કાતર વડે કે ખાસ ચીપીયા વડે આપવામાં આવે છે. આ રીતનો ઉપયોગ ખાસ કરી ને બુંડમાં થાય છે.

**૧૦. વિંગ અને લેગ બેન્ડ:** આ રીતનો ઉપયોગ મરધા કે બતકમાં ઓળખાણ આપવા માટે થાય છે. જેમાં



ફર્મનું નામ, નંબર વગેરે માહિતી લખેલી ટેગ મરધાની પાંખ અથવા પગમાં પહેરાવવામાં આવે છે.

**૧૧. ટો પંચિંગ:** આ રીત ઉપયોગ પણ મરધામાં કરવામાં આવે છે. જેમાં પંજાની વચ્ચે રહેલ ચામડીમાં



કાણું પાડવામાં આવે છે. આ રીતનો ઉપયોગ પક્ષીના સમુહની ઓળખ આપવા માટે થાય છે.



**૧૨. ઈલેક્ટ્રોનિક માર્કિંગ:** આ રીતમાં ઈલેક્ટ્રોનિક ચીપનો ઉપયોગ થાય છે. જેમાં જાનવરની સંપૂર્ણ માહિતી હોય છે. જેને જાનવરની ચામડીની નીચે ફિક્સ કરવામાં આવે છે જેથી જાનવર દૂર હોવા છતા તેની માહિતિ ભેણવી શકાય છે. અત્યારે આ પદ્ધતિનો ઉપયોગ વધુ પ્રચલિત થઈ રહ્યો છે.

**નોંધ :** કોઈપણ ઓળખ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે પ્રવર્તમાન પ્રાણી કલ્યાણના કાયદાની જોગવાઈઓ અવશ્ય ધ્યાને લેવી જરૂરી છે.



# દૂધમાં થતી બેળસેળ અને તેની રસાયણિક પદ્ધતિ દ્વારા થતી ચકાસણી

પ્રો. એ.એસ. હટિયાણી, પ્રો. તન્મય હાજરા અને પ્રો. એ.જે. ડેસીયા

કોલેજ ઓફ કેરી સાચન્સ, અમરેલી

હાલમાં (વર્ષ ૨૦૧૪-૧૫, NDBB આંકડાકીય માહિતી) ભારત દેશ દુનિયામાં દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભારત દેશ વર્ષનું ૧૪૬૭ લાખ મેટ્રીક ટન દૂધનું ઉત્પાદન કરે છે. જેમાં ગુજરાતનું ઉત્પાદન લાખ મેટ્રીક ટન છે. ભારત દેશ દુનિયાના કુલ દૂધ ઉત્પાદનમાં ૧૭ %નો ફાળો આપે છે. આ ઉત્પાદનનો દર વર્ષે ૪ થી ૫ % ના લેખે વધતો રહે છે. આ કુલ દૂધ ઉત્પાદનમાં ૫૪% ફાળો લેંસના દૂધનો, ૪૩ % ફાળો ગાયના દૂધનો અને બાકીના ૩ %નો ફાળો બકરી અને ઘેટાંના દૂધનો છે. આ દેશના નાગરિકને રોજના ૨૮૧ ગ્રામ દૂધનો જથ્થો અને ગુજરાતમાં ૪૩૫ ગ્રામ દૂધનો જથ્થો માથાઈઠ ખોરાક તરીકે ઉપલબ્ધ છે. ગુજરાતમાં ૧૭ સહકારી અને લગભગ ૧૫ જેટલી ખાનગી સંસ્થાઓ દૂધ અને તેને લગતા ઉદ્યોગમાં કાર્યરત છે. જે ગુજરાતમાં કુલ ઉત્પાદનના ૪૩% થી વધારે દૂધ પ્રોસેસિંગ કરે છે.

દેશના કુલ દૂધ ઉત્પાદનના ૧૫ થી ૨૦% દૂધનું વેચાણ સંયોજીત સંસ્થા દ્વારા થાય છે. જ્યારે ૫૫ % દૂધનું સંચાલન રૂઢીગત હલવાઈ દ્વારા તથા ૨૫ % ફેરીયા દ્વારા થાય છે. કુલ દૂધ ઉત્પાદનના ૫૫% દૂધનું રૂપાંતર ભારત દેશની રૂઢીગત દૂધની બનાવટમાં થાય છે, જેમકે ધી, માવો, દહીં, છન્ના, પનીર, શ્રીંબંડ વગેરે. પ્રવાહી દૂધનો ખાદ્ય પદાર્થ તરીકે કુલ દૂધ ઉત્પાદનના ૪૦ થી ૪૫ % જેટલો ઉપયોગ થાય છે. જ્યારે ૫% જેટલા દૂધનું રૂપાંતર પશ્ચિમના દેશોની દૂધની બનાવટમાં થાય છે, જેમકે ચીજ, દૂધનો પાઉડર વગેરે.

દૂધનો વ્યવસાય માનવ જીતની ઉમદાસેવા છે. આપણા ભારતનાં ધર્મ ગ્રંથોમાં દૂધ અને તેની બનાવટો રોજબરોજના વપરાશમાં અને ધાર્મિક વિધિઓમાં મહત્વનું સ્થાન પામેલ છે. દેવ સ્થાનોમાં તથા ધાર્મિક વિધિઓમાં દૂધ અને અને દૂધની બનાવટોના ઉપયોગને કારણે તેમને શુદ્ધતાનો પર્યાય ગણવામાં આવે છે. આ હકિકતને જાણવા છતાં કેટલાક વિકૃત માનસ ધરાવતા દૂધના ઉત્પાદકો અથવા વચેટીયાઓ વધુ નફો કમાવાની લાલચમાં દૂધમાં સસ્તા રસાયણીક પદાર્થો અને પ્રાણીજન્ય ચરબી (મટન ટેલો) ઉમેરીને પ્રવાહી દૂધ અને તેની બનાવટો જેવી કે માવો, પનીર, ધી, મીઠાઈઓ વગેરેનું વેચાણ કરે છે. દૂધમાં જે સસ્તા રસાયણો ઉમેરવામાં આવે છે તે પેટ અને જઈની બીમારીઓ, ચાંદા, ચામરીના રોગ, ટાઈફોન, કોલેરા, કિડની અને પ્રજનન તંત્રના રોગો અને ક્યારેક્ટો કેન્સર જેવી ભયંકર બિમારીને નોતરે છે. દૂધમાં તથા ધીમાં પ્રાણીજન્ય ચરબી ઉમેરીને જાણે અજાણ્યે ભારતના વૈદીક છિન્દુ ધર્મને બ્રાષ્ટ કરે છે, માટે આવી બેળસેળ કરનારી વ્યક્તિ આપણા સમાજ માટે શ્રાપરૂપ છે અને કુદરતનો મોટો ગુનેગાર છે. માટે આવી વિકૃત માનસ ધરાવતી વ્યક્તિને રંગે હાથે પકડીને કાનુની કાર્યવાહી કરીને કડકથી કડક સજા કરવી જોઈએ.

ભારત દેશના નાગરિકોને શુદ્ધ અને સાત્વીક ખાદ્ય ખોરાક મળે એ માટે ભારત સરકારે ખાદ્ય બનાવટોને PFA (પ્રિવેન્શન ઓફ ફુડ એન્દ લાન્ડ્રેશન એક્ટ), AGMARK (ફરીજીયાત) BIS

(મરજ્યાત) અને FSSAI (કુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા) હેઠળ આવરી લીધા છે. આમ છતા વધુ નફો કમાવાની લાલચમાં ઉત્પાદકો અથવા વચેટીયાઓ સસ્તા પદાર્થો ઉમેરે છે.

## દૂધ અને દૂધની બનાવટોમાં ભેણસેળ થવાના કારણો:-

દૂધમાં ભેણસેળ થવી એટલે દૂધ ના સામાન્ય બંધારણ માં ફેરફાર કરવો. આ ફેરફાર બહારથી પદાર્થો ઉમેરીને અથવા તો દૂધમાંથી કોઈ કિંમતી પદાર્થ કાઢી લેવો જેમકે, દૂધની ચરબી. ભારત દેશમાં ગાયના દૂધના મૂલ્યનું ચુકવણું ફેટ તથા એસ.એન.એફ. (સોલીડ નોટ ફેટ) તથા બેંસના દૂધના મૂલ્યનું ચુકવણું ફેટની ટકાવારીને આધારે કરવામાં આવે છે. વધુ પૈસા કમાવાની લાલચમાં ઉત્પાદકો ફેટની ટકાવારી વધારવા માટે વનસ્પતિજન્ય ચરબી તથા પ્રાણીજન્ય ચરબી જેવીકે, મટન ટેલો ઉમેરે છે તથા એસ.એન.એફ.ની ટકાવારી વધારવા યુરીયા, એમોનિયમસલ્ફેટ વગેરે જેવા રસાયણિક પદાર્થો અને મેંદો દૂધમાં ઉમેરે છે. ભારત દેશમાં જેમજેમ વસ્તીમાં વધારો થાય છે તેમ તેમ દૂધની માંગ વધતી જાય છે, પણ દૂધનું ઉત્પાદન તેટલા પ્રમાણમાં વધતું નથી. માટે આ માંગને પહોંચી વળવા તથા પૈસા કમાવા વચેટીયાઓ સિન્થેટિક દૂધ બનાવીને વેચાણ કરે છે. ભારતના કેટલાક ભાગોમાં સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરારૂપ એવું કૃત્રિમ દૂધ પણ બનાવીને શુધ્ય દૂધમાં ભેણવવામાં આવી રહ્યું છે. કૃત્રિમ દૂધ બનાવવા માટે યુરીયા, મીઠું, ખાવાનો સોડા, ખાંડ, તેલ, કીટરજન્ટ અને પાણી જેવા પદાર્થોનો ઉપયોગ થાય છે. આવા કૃત્રિમ દૂધને શુધ્ય દૂધમાં ૫% ની માત્રા સુધી ભેણવવા માં આવે તો તેને પકડવું મુશ્કેલ બને છે, કારણે આના કારણે દૂધના સ્વાદ, રંગ અને

ઘનત્વમાં પારખી શકાય તેવા ફેરફારો થતા નથી. દૂધની કુદરતી પ્રકૃતિને કારણે તેમાં કરેલી ભેણસેળ સરળતાથી પકડી શકાતી નથી. આ બાબતનો લાભ લોકોના સ્વાસ્થ્યના ભોગે કેટલાક લેભાગુ તત્વો ઉઠાવે છે. વળી નજીકના ભૂતકાળમાં જ બાળકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા રસાયણ મેલામાઈનની ભેણસેળ આપણા પડોશી દેશમાં પ્રકાશમાં આવી હતી.

## દૂધમાં ભેણસેળ માટે વપરાતા કેટલાક પદાર્થો / રસાયણો અને તેની આડ અસરો :-

- ફોર્મેલીન:** જેરી અને જીવલેણ રસાયણ છે.
- યુરીયા :** પેટ અને જઠરની બીમારીઓ પેદા કરે છે.
- હાઈડ્રોજન પેરોક્સાઈડ:** પ્રોટીનની ગુણવત્તાને અસર કરે છે. વિટામીન અને સલ્ફર ધરાવતા એમીનોએસીડની ઉપયોગીતાને અસર કરે છે. ચાંદા / અલસર વગેરે જેવા વિકારો પેદા કરે છે.
- ડીટર્જન્ટ:** પેટનો દુઃખાવો, ચાંદા / અલસર જેવા વિકારો પેદા કરે છે.
- કોસ્ટીક સોડા :** કેન્સરપ્રેરક રસાયણ છે. ચામડીના રોગો પેદા કરે છે તથા પ્રોટીનની ગુણવત્તાને અસર કરે છે.
- સ્ટાર્ચ્ય :** સસ્તા પ્રકારનું સ્ટાર્ચ્ય વાપરવામાં આવે છે જે દુષ્પિત રોગજન્ય જીવાણુંઓ ધરાવી શકે છે.
- માલ્ટ્રોડેકસ્ટ્રીન :** સસ્તા પ્રકારનું માલ્ટ્રોડેકસ્ટ્રીન વાપરવામાં આવે છે જે દુષ્પિત રોગજન્ય જીવાણુંઓ ધરાવી શકે છે.
- પાણી :** મોટે ભાગે દુષ્પિત તથા રોગજન્ય

જીવાણું ઓધરાવતું પાણી વાપરવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક પાણીજન્ય રોગો જેવા કે ટાઈફોઇટ, કોલેરા અને કમળો પેદા કરે છે.

૮. મેલામાઈન : કીડની અને પ્રજનનતંત્રના રોગો પેદા કરે છે અને તેની અસરથી બાળકોની કીડની સંપૂર્ણપણે કામ કરતી બંધ પણ થઈ શકે છે.

૯૦. ગ્લુકોઝ : સસ્તા પ્રકારનું અને નીચી ગુણવત્તાવાળું ગ્લુકોઝ વાપરવામાં આવે છે, જે રોગજન્ય જીવાણું ઓધરાવી શકે છે.


૧૧. તેલ / વનસ્પતિ ફેટ : સસ્તા પ્રકારનું અને નીચી ગુણવત્તાવાળું ખાદ્ય અને અખાદ્ય તેલ ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થને વિવિધ રીતે હાનિકારક છે.

**દૂધમાં ભેણસેળ માટે વપરાતા પદાર્થો / રસાયણોનું પરીક્ષણાં:-**

૧. હાઈડ્રોજન પેરોક્સાઈટ : એક કસનળીમાં ૨ મી.લી. દૂધ લો. તેમાં પાંચ ટીપાં પેરા ફીનાઈલ ડાય એમાઈનનું રસાયણ (૨%) નાખો, ભૂરા રંગનું દ્રાવણ હાઈડ્રોજન પેરોક્સાઈટ ની હાજરી દર્શાવે છે.



૨. ફોર્માલિન હેનર ક્રોટી : ૫ મી.લી. દૂધને એક કસનળીમાં લો. બીજી કસનળીમાં દસ મી.લી. ગંધકનો તેજબ લઈ તેમાં એક ટીપુફેરીક કલોરાઈડનું (૧૦%) રસાયણ



નાખો. ઉપરોક્ત દ્રાવણ ધીરેથી પ્રથમ કસનળીમાં લીધેલ દૂધમાં એવી રીતે નાખો કે તેનું કસનળીમાં દૂધ અને તેજબનું સર અલગ બને. બે સરાની સંપર્ક રેખાનો રંગ જાંબલી રંગનો થાય તો ફોર્માલિન હાજરી દર્શાવે છે. લીલો અથવા કથ્થઈ રંગ ફોર્માલિન હાજરી ગેરહાજરી દર્શાવે છે.

#### ૩. બોરીક એસીડ / બોરેકશે :

દૂધને એક કસનળીમાં લઈ મીઠાનો જલદ તેજબ નાખો ફાડો (૭ મી.લી. લઈ ૧૦૦ મી.લી. દૂધમાં નાખો) તેમાં ભેજ મુક્ત ટરમરીક પેપર (હળદરની પણી) ડૂબાડો અને પછી હવામાં સુક્પો. પછીનો રંગ લાલ રંગનો થાય તો બોરીક એસીડની હાજરી બતાવે છે.


Boric Acid



Absent Present

૪. મેદો (સ્ટાર્ચ) : એક કસનળીમાં ૩ મી.લી. દૂધ લઈને બન્નર ઉપર ઉકાળો પછી કંદુ કરી તેમાં આયોડીન (૧ ટકા) ના દ્રાવણનાં ટીપાં નાખો. ભૂરા રંગનું દ્રાવણ મેંદાની (સ્ટાર્ચની) હાજરી દર્શાવે છે.


Maltodextrin / Maltose



Absent Present

૫. શર્કરા (ખાંડ / મોરસ) : એક કસનળીમાં ૧૫ મી.લી. દૂધ લો. તેમાં એક (૧) મી.લી. મીઠાનો જલદ તેજબ અને ૦.૧ ગ્રામ રીસોસ્નિઓલ નાંખી બરાબર હલાવો ત્યારબાદ આ કસનળીને ઉકળતા પાણીમાં પાંચ મિનીટ


Sugar



Absent Present

સુધી રાખો. લાલ રંગનું દ્રાવણ શર્કરા ની હજરી બતાવેછે.


**૬. સોડા (ખાવાનો/ધોવાનો/કોસ્ટીક) :** એક કસનળીમાં પાંચ મી.લી. દૂધ લો. તેમાં આદકોહોલીક રોઝાલીક એસીડના થોડા ટીપાં નાખો અને બચાવું. જો દ્રાવણનો રંગ લાલ ગુલાબી રંગનો થાય તો સોડા ઉમેરેલ છે તેમ કહેવાય.



**૭. યુરિયા :** એક કસનળીમાં પાંચ મી.લી. દૂધ લો તેમાં ૫ મી.લી. ડાય મીથાઈલ એમીનોબેન્જાઈડીહાઈડ્રૂનું દ્રાવણ નાખો અને બચાવું. હલાવો. પીળા રંગનું દ્રાવણ યુરિયા ઉમેરેલ છે તેમ કહેવાય.




**૮. નાઈટ્રોટ્રેટ્સ :** એક કાચના બીકરમાં ૧૦ મી.લી. દૂધ લઈ તેમાં ૧ મી.લી. એસીટીક એસીડ (૧%) નાખો મિશ્રણને ગાળી લો. ગાળણમાં ડાઈફીનાઈલ એમાઈન પ્રક્રિયકના બે ટીપાં નાખો. ઘાટા ભૂરા રંગનું દ્રાવણ નાઈટ્રોટ્રેટ્સ ધરાતા પાણીની (તળવ/નદી નું પાણી) હજરી દર્શાવેછે.



**૯. એમોનિયમ સલ્ફેટ :** એક કસનળીમાં પાંચ મી.લી. ગરમ દૂધ લઈ તેને યોગ્ય એસિડ લઈ ફડો. ત્યારબાદ તેને ગાળી લો. ગાળણને એક બીજી કસનળીમાં લઈ તેમાં બેરિયમ કલોરાઇડ (૫ ટકા) ના

દ્રાવણનાં થોડા ટીપાં નાખો. જો અવક્ષેપની હજરી જણાય તો એમોનિયમ સલ્ફેટ ઉમેરેલ છે તે મ કહેવાય.

Ammonium Sulphate



**૧૦. વનસ્પતી ધી અને તેલની ભેળસેળ માટેની કસોટી (બી.આર.આંક) :** ભેળસેળ યુક્ત દૂધમાંથી ફેટ કાઢી તેનું ધી બનાવો. આવા ધીને ૪૦ સે. ટાપમાન સુધી ગરમ કરો. આજ ટાપમાને ધીનાં એકાદ બે ટીપાં બ્યુટાયરો રીળેક્ટોમીટર નામના સાધન ઉપર મુકો અને રીડીંગની નોંધ લો. ૪૪ કરતાં વધારે બી.આર. આંક વનસ્પતી ધી અને/અથવા તેલની હજરી દર્શાવેછે.



બધા ખાદ્ય પદાર્થોમાં દૂધ એ જટીલ પોષક તત્વોનું મિશ્રણ છે. તેમાં ભેળસેળ સહેલાઈથી કરી શકાય છે. દૂધમાં સહેલાઈથી ભેળસેળ ચકાસી શકાય તે માટે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ, આઝાંદ અને રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાન, કરનાલ તેમજ અન્ય ખાનગી સંસ્થા દ્રારા એડલટ્રેનેજ ડીટેક્શન કિટ (ભેળ સેળની ચકાસણી માટે) તૈયાર કરવામાં આવી છે. જેની કિંમત રૂપિયા ૩૦૦૦ થી ૫૦૦૦ હોય છે. એક દૂધના નમૂનાની ચકાસણીની કિંમત ૪૦ થી ૫૦ રૂપિયા થાય છે. આ કિટની મદદથી ઉપર દર્શાવેલ કોઈ પણ પદાર્થ જો દૂધમાં નાખેલ હોય તેમજ આ ઉપરાંત એલીજારીન, ડીટરજન્ટ, મીઠુ, દૂધનો પાવડર, ગલુકોઝ, સેલ્ફ્યુલોઝ અને તળાવનું પાણી દૂધમાં ભેળસેળ તરીકે ઉમેરેલ હોય તો સહેલાઈથી પારખી શકાય છે.



પશુપાલન પોલીટેકનિક, રાજ્યુર (નવા), હિંમતનગર



કોલેજ ઓફ ડેરી સાયન્સ, શેડૂભાર, અમરેલી



**PRINTER MATTER**

**BOOK-POST**

પ્રતિ,

રવાના :

વિસ્તરણ શિક્ષણ નિયામક,

કામદેનુ ચુનિવર્સિટી

કર્મયોગી ભવન, બ્લોક-૧, બી ૧ વીંા, ચોથો માળ,

સેક્ટર-૧૦-એ, ગાંધીનગર-૩૮૨ ૧૦

ફોન : ૦૭૯-૬૪૭૨૦૧૩૧

E-mail : dee@ku-guj.com | Website : [www.ku-guj.org](http://www.ku-guj.org),